https://archive.org/details/bk111-1/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

સતપંથ જ્યોત

વર્ષ : ૨

અંક : ૧૦

સળંગ અંક : ૨૨

ઓગસ્ટ ૧૯૯૫

* પ્રકાશક *

સતપંથ પ્રકાશન સમિતિ

શ્રી સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા-૩૮૨૪૨૫ તા. દસક્રોઈ, જિ. અમદાવાદ.

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk111-1/page/n2/mode/1up

1995-08 -Satpanth Jyot (111)

realpatidar.com

સતપંથ જ્યોત

વર્ષ : ૨
અંક : ૧૦
સળંગ અંક : ૨૨

ઓગસ્ટ
૧૯૯૫

* પ્રકાશક *
સતપંથ પ્રકાશન સમિતિ
શ્રી સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા-૩૮૨૪૨૫ તા. દસક્રોઈ, જિ. અમદાવાદ.

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n3/mode/1up

realpatidar.com

પ્રાર્થના એટલે શું ?

–મધુશ્રી એ. પટેલ (ભવાનીપુરા-મોડાસા)

* પ્રાર્થના એ મોક્ષ મંદિરમાં પ્રવેશ કરવાની પગદંડિકા !!
* પ્રાર્થના એટલે હૃદયની પરમ-આત્મા બનવાની સાચી ઝંખના !!
* પ્રાર્થના જીવનના ઝંઝાવાતો અને સુખ-દુઃખ વગેરેમાં જીવાત્માને સમભાવી બનાવનારૂ એક અદ્‌ભુત અલૌકિક રસાયણ...!!!
* પ્રાર્થના એટલે ભક્તને ભગવાન સાથે જોડતો મહાન પુલ !!
* પ્રાર્થના એટલે અજ્ઞાનરૂપી મોહાંધકારને દૂર કરવા દિવ્ય પ્રકાશ આપનારી ઉઘડેલી બારી !!
* પ્રાર્થના એટલે ભૌતિકતાના વિવિધ તાપમાંથી આધ્યાત્મિકતાના ઉન્નત શીતળ શિખરે લઈ જનારી પ્રેરણા-પગદંડી !!

સત્‌પંથ સંદેશ

–મહેન્દ્ર એચ. પટેલ (લાલપુરા-મોડાસા)

હે ધર્મ બંધુ,

તારામાં ઇશ્વરનું અસીમ બળ છુપાયેલું છે. દ્રઢતાથી શુભ સંકલ્પને વળગી રહે. નિયમિત ભક્તિ, ગુરુ આશિર્વાદ અને સત્સંગ દ્વારા તારી મહાન શક્તિઓને વિકસિત કર. માતા-પિતાનુ અને સતપંથ ધર્મનું ગૌરવ વધારી મોક્ષ પ્રાપ્ત કરવાની તારી શક્તિ જગાડ. ખંતથી તું ભક્તિ કર. સમય વ્યર્થમાં વેડફીશ નહી. ' કુસંગના કાદવમાં પડીશ નહી. તું તારી આત્મશક્તિને જગાડ. તને મહાન થવું એટલું જ સહજ થઈ પડશે જેટલું સુર્યોદય થતાં સૂર્યમુખીને ખીલવું સહજ થઈ પડે. સદાય પ્રસન્ન રહેવું ૐશ્રી નિષ્કલંકી નારાયણની સર્વોપરી ભક્તિ છે.

વાર્ષિક લવાજમ :	ભારતમાં રૂા. ૪૨/-	વિદેશમાં : રૂા. ૧૮૫/-
આજીવન ગ્રાહક :	ભારતમાં રૂા. ૪૫૧/-	વિદેશમાં : રૂા. ૧૪૦૦/-
અમર ગ્રાહક :	ભારતમાં રૂા. ૧૦૦૧/-	વિદેશમાં : રૂા. ૩૦૦૧/-

છુટક નકલ રૂા. ૪/-

• સતપંથ જ્યોત દર મહિનાની દશ તારીખે પ્રગટ થશે. • ગ્રાહકે પોતાના સરનામામાં ફેરફાર કરવાનો હોય તો નીચેના સરનામે પત્રથી જાણ કરશો. • પત્ર વ્યવહાર કરતી વખતે પોતાનો ગ્રાહક નંબર અવશ્ય જણાવશો. • ગમે તે માસથી ગ્રાહક થઈ શકાય છે. • પોતાના ગામના અંકોના વિતરણ કાર્યમાં સેવા આપનાર વ્યક્તિએ પોતાનું નામ અને સરનામું જણાવવું.

પત્રવ્યવહાર તથા લવાજમનું સરનામું :-**સતપંથ પ્રકાશન સમિતિ**
સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ જિ. અમદાવાદ 382425

ટેલીફોન STD | 02718-88-227
02718-88-229

સંપાદક :- **શ્રી સામજીભાઈ કે. પટેલ**

મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. ટે. નં. ૩૬૩૬૩૧

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n4/mode/1up

1995-08 -Satpanth Jyot (111)

realpatidar.com

સતપંથ સંપ્રદાયનું ધાર્મિક પ્રેરણા આપતું માસિક

સતપંથ-જ્યોત

[માસિક]

વર્ષ ૨] અંક ૧૦ * ઓગસ્ટ-૧૯૯૫ * [સળંગ અંક ૨૨

— લેખકોને વિનંતી —

સતપંથ જ્યોત, સતપંથ સંપ્રદાયની માસિક પત્રિકા છે. તેમાં સંપ્રદાયને તથા સર્વોપયોગી થાય તેવી મુખ્યત્વે વાર્તા, લેખ, જીવન વૃત્તાંત, કાવ્ય, ભજન વગેરે કૃતિઓ પ્રગટ થાય છે. જે સાદી-સરળ ભાષામાં આલેખાયેલી હોવી જોઈએ.

અન્યત્ર પ્રગટ થઈ ગયેલી કે, કોઈ પત્ર-પત્રિકામાં છપાયેલી કૃતિઓ સ્વીકારવામાં આવશે નહીં.

કૃતિઓ ફુલસ્કેપ કાગળ ઉપર એક જ બાજુએ સારા અક્ષરે લખાયેલી હોવી જોઈએ. લખાણની તમામ જવાબદારી લેખકની રહે છે. પોસ્ટ કાર્ડ કે અંતરદેશીય પત્ર પર લખેલા લેખ રદ બાતલ ગણાશે.

પોતાનો લેખ અંકમાં ફરજિયાત પ્રગટ થાય તેવો આગ્રહ રાખવો નહીં.

સતપંથ જ્યોતમાં પ્રગટ થતા બધા લેખો સાથે સંપાદક હંમેશાં સહમત છે તેમ માનવું નહિ. લેખ પ્રસિદ્ધ કરવો કે નહિ, તે સંપાદકને આધિન છે.

—સંપાદક

સંપાદકીય

વહાલા વાચકો,.... જયશ્રી નિષ્કલંકી ...નારાયણ....

ભારતની પ્રજાની જીવાદોરી સમી મહાન સંસ્કૃતિ એટલે મોક્ષ પામવાના લક્ષણવાળી પુરૂષાર્થની સંસ્કૃતિ જેમ માછલીની જીવાદોરી પાણી છે તેમ...

કમનસીબે આ સંસ્કૃતિ પર પશ્ચિમની વિકૃતિ સંસ્કૃતિએ હુમલો કર્યો, પરંતુ એ સંસ્કૃતિ તૂટી નથી પડી, કારણ કે તેના મુળીયાં ઊંડા છે. પરંતુ થોડી હચમચી જરૂર ગઈ છે. આ મહામુલી સંસ્કૃતિના પાયા પર ધર્મની ઈમારત ઊભી છે. એટલે ધર્મની રક્ષા કરવા માટે પણ સંસ્કૃતિની રક્ષા કરવી અનિવાર્ય થઈ પડી છે.

જો આપણે સંસ્કૃતિનું જીવન નહીં જીવીએ તો આપણો સમાજ બરબાદ થશે, કુટુંબ છિન્ન ભિન્ન થશે, વ્યક્તિ અશાંત બની દુર્ગતિ પામશે, આપણે બીજા સમાજની વાત કરવી નથી. ફક્ત આપણા સમાજની જ વાત કરવી છે. સમાજ સંસ્કૃતિના પાલનથી જ જીવંત રહી શકશે જો આમ નહીં થાય તો સમાજ, કુટુંબ રચના ખોરંભે પડશે....આ માટે આપણા સમાજનો પાયો મજબૂત બને, બાળકોને નાનપણથી જ સુસંસ્કારી બનાવી શકાય તેવા ઉચ્ચ હેતુથી બાળ શિક્ષણ શિબિરો તેમજ "શિબિર તમારે દ્વારે" જેવા કાર્યક્રમથી મહદઅંશે આપણને સફળતા મળી છે. આપણા બાળકોમાં ઘણી બધી શક્તિઓ છુપાયેલ છે. જરૂર છે તેને

(અનુસંધાન પાન ૪ ઉપર)

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n5/mode/1up

realpatidar.com

* મન ચિંતામણી પુસ્તકમાંથી *

(શ્રી ઈમામશાહ મહારાજ રચીત)

[ગતાંકથી ચાલુ....]

આપે મનને અવિચલ ઠામ,
નવ ઊપજે ક્રોધ ને કામ.... (૧)
સત્ય જ્ઞાને વિવેક ઊપજે,
ત્યારે મન સઘળાં કુલક્ષણ તજે.... (૨)
જ્ઞાન યથાર્થ અનુભવે લઈએ,
ત્યારે મન કલ્પિતથી રહીએ... (૩)
વિષય વાસના કરીએ ત્યાગ,
ધરીએ ભક્તિ તીવ્ર વૈરાગ્ય.... (૪)
મનને જીતવા ચાહે જેહ,
મુનિવર અંતરમાં કરવો એહ.... (૫)

તુંહી સાચા સાહેબ હો...
વળી જુઓ વૈરાગ્યને,
સાચી ભક્તિ એહ,
વણ વૈરાગ્યે થર નહિ,
મુનિવર જાણો તેહ. (૩૯)

બ્રહ્મ જ્ઞાન સત્યે મન ધરીયે,
ભક્તિ જ્ઞાને નિત્ય વિચાર જ કરીએ...(૧)
બ્રહ્મ જ્ઞાને મન થર થાયે,
મુનિવર બીજે નથી કોએ ઉપાયે... (૨)
પર નીમનુ કરે અભ્યાસ,
સમજણ માંહે આવે વિનાશ... (૩)
જેને નિત્ય સત્યસંગનું ચિતવન,
તેનું નિશ્ચે થર થાય મન... (૪)
દેહ સ્વભાવ એણી પેર ટળીએ,
જો મન આત્મા ચૈતન્યને મલીયે.... (૫)
તુંહી સાચા સાહેબ હો....
આપણું આપ ચિને નહિ,
કરે અવર શું પ્રીત,
કદીયે જ્ઞાન ન ઊપજે,
ન થાયે સદ્દગુરુ સાથે પ્રીત. (૪૦)

[ક્રમશઃ]

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n6/mode/1up

realpatidar.com

❋ શ્રી સદ્દગુરૂ ઈમામશાહ મહારાજ જીવન વૃત્તાંત ❋

(ગતાંકથી ચાલુ)

શિષ્યોને ઘણી નવાઈ લાગી. તેમને લાગ્યું કે એટલે દૂર સુધી શી રીતે પહોંચી શકાશે અને મરેલા માણસ પાસેથી 'પાંતી' પણ કેવી રીતે મળી શકે ? વળી આપણને પણ તે શી રીતે લઈ જઈ શકશે ? બધું જ આશ્ચર્યજનક લાગે છે છતાં કેટલાક અનુયાયીઓ તેમની સાથે જવા તૈયાર થયા.

સદ્દગુરુએ પોતાનો રથ તૈયાર કરવા હાજરબેગને કહ્યું. અને લોકોને કહ્યું કે જેમને સાથે આવવું હોય તેમણે રથને મજબૂત રીતે પકડી રાખવો. તેથી જેમને ગુરુમહારાજ સાથે જવાની ઇચ્છા હતી એવા ૪૦ અનુયાયીઓ આગળ આવી તેમણે રથ મજબૂત રીતે પકડી રાખ્યો. તે વખતે રાતનો ૩–૩॥ નો સુમાર હતો. લોકોને સદ્દગુરુએ કહ્યું કે દરેકે પોતાની આંખો મીચી પ્રભુ સ્મરણ કરવું આંખો બંધ કરતાં જ રથ ઉંચો થઈ વાયુવેગે ચાલવા. લાગ્યો અને સૂર્યોદય પહેલાં મુલતાન આવી થોભ્યો. તે વખતે પોતાના પિતાંનું શબ લઇ જવાનું હતું. સદ્દગુરુએ આગળ જઇ પોતાનો હિસ્સો લેવા માટે શબ થોભાવવા કહ્યું. પછી શબ પાસે જઈ બોલ્યા, "પિતાજી મારો હિસ્સો હજુ સુધી મળ્યો નથી તે આપવાની કૃપા કરો."

આ સાંભળી લોકો આશ્ચર્યચકિત થયા. તેમણે ઈમામશાહને કહ્યું કે આ શબ પાસેથી તમને શું મળવાનું છે ? તમારો હિસ્સો તો ઘેર જ રાખેલો છે. તે કાંઇ આ શબ સાથે થોડો જ છે ? માટે ચિંતા કે મોહ કરશો નહીં.

ઇમામશાહ બોલ્યા, "ભાઇઓ મને તો તે હિસ્સો મળવાનો જ છે, પણ મારે તે (સ્થાવર કે જંગમ મિલકત) લઇ શું કરવાનું છે ? એ તો નાશવંત છે. મારે એની બિલકુલ જરૂર નથી. મને તો બીજો અવિનાશી હિસ્સો જોઇએ છે અને પિતાજી તે લઇ ગયા છે મને તે મળ્યા વગર હું આ શબ લઈ જવા દઇશ નહીં."

કેટલાક અશ્રદ્ધાળુ લોકોને ઇમામશાહનું આ કહેવું ગમ્યું નહીં. તેમને મૂર્ખ ઠરાવી તે હસવા લાગ્યા. તે બોલ્યા કે ઇમામશાહ હજુ અજ્ઞાની છે તેમને સમજશક્તિ નથી. માટે તેમના કહેવા ઉપર વિશ્વાસ નહીં રાખતા શબ ઉપાડો. તેથી કેટલાક લોકો શબ ઉપાડવા લાગ્યા પણ તે ઉંચકી શકાયું નહીં તેથી લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.

બધાની નજર ઇમામશાહ મહારાજ અને તેમના પિતાના શબ ઉપર લાગી રહી. સવા પ્રહર જેટલો સમય વિતી ગયો. એટલામાં પિતાએ પોતાનો હાથ બહાર કાઢયો અને પોતાના દેહ ઉપરની માળા કાઢી પુત્ર ઇમામશાહને આપી. પણ ઇમામશાહને એટલેથી સંતોષ થયો નહીં. આખરે તેમના પિતાએ પોતાનું મુખ–કમલ ખોલી તેમાંથી 'સાકર' (એક પ્રકારની દૈવી કળા) કાઢી ઇમામશાહના મુખમાં મૂકી. આ જોઈ લોકો આશ્ચર્યચક્તિ થયા. શબ જીવતું થયાનું જોઈ ઇમામશાહ સાથે આવેલા લોકો આનંદમાં આવી જયજયકાર કરવા લાગ્યા. પછી બધાએ આદરભાવથી શબ ઊંચકયું અને છેવટે ઇમામશાહે પોતાના હાથે પિતાજીને સમાધી આપી.

૫. બ્રહ્મકુળાનો પ્રતાપ :

લક્ષણ પૂરણ બ્રહ્મના રે, થયા આજ રે જોય ।
દયા ક્ષમા ને દીનતા રે, સત નામની હોય ॥

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n7/mode/1up

realpatidar.com

હું પદને અતિ ઈર્ષા રે, ટાળો સર્વે તમામ ।
તેથી કરીને જાણીયા રે, સાચા બ્રહ્મ રે નામ ॥

બ્રહ્મઋષિ તેથી કહ્યા રે, સાંભળો મારા મિત્ર ।
સાચપણેથી રાખજો રે, સદા એહી જ તંત્ર ॥

બ્રહ્મ લક્ષણ જોઈને રે, થયું બ્રાહ્મણ નામ ।
લક્ષણ નથીએ જેહમાં રે, ટાળો એનું રે ઠામ ॥

સત્ લક્ષણ જેહમાં, સત્પંથી સાચા સોય ।
સત્ વિના સુનું સદા, વેશ જ મિથ્યા હોય ॥

(ક્રમશ આવતા અંકે)

□

(પહેલા પેજનું ચાલુ)

યોગ્ય રસ્તે વાળવાની મને અંઃતકરણ પૂર્વક શ્રદ્ધા છે કે આપણા ભુલકાંઓ આવતી કાલે જરૂર સુકાન સંભાળી શ્રેષ્ઠ આદર્શ સમાજનું ઉદાહરણ પુરૂ પાડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

કદાચ સમગ્ર દેશ માટે આપણે ન કરી શકીએ તો દરેક કુટુંબના વડીલે પોતાના ઘર પૂરતી તેને જીવંત કરી દેવાનો દ્દઢ સંકલ્પ કરવો જોઈએ આમ પ્રત્યેક ઘર ઉગરી જશે, તો આખો સમાજ ઉગરી જશે અને આખો સમાજ ઉગરી જશે જે એક વિરાટ – ભગીરથ કાર્ય થયેલું ગણાશે.......

ખાસ સુચના :

વાલીઓ તથા તમામ શિબિરાર્થી બાલ–બાલિકાઓને જણાવવાનું કે શિબિરાર્થી-ઓના બિલ્લા બનાવવાના હોઈ દરેક શિબિરાર્થીએ પોતાનો પાસપોર્ટ સાઇઝના કલરમાં ત્રણ ફોટા તા. ૨૦–૮–૯૫ સુધીમાં નીચેના સરનામે મોકલી આપવા તમામ શિબિરાર્થીએ પોતાના ફોટા પાછળ પોતાનું નામ, સરનામુ અવશ્ય લખવું, તેમજ ફોટા સારી ક્વૉલીટીના મોકલવા વિનંતી...

—શ્રી શામજીભાઈ કે. પટેલ
શ્રી સતપંથ બાળ–બાલિકા શિબિર
આયોજન સમિતિ,
પ્રેરણાપીઠ, પીરાણા,
તા, દસક્રોઈ, જી. અમદાવાદ–382425.

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n8/mode/1up

realpatidar.com

✻ કૃપા હોય જો ગુરૂદેવની.....! !! ✻

(બનેલી સત્ય ઘટનાઓ)

સતપંથ સંપ્રદાયના આદ્યગુરૂ શ્રી ઈમામશાહ મહારાજ તત્ત્વજ્ઞાની અને સાથો સાથ મહાન તેજસ્વી સુફીસંત હતા. તેઓએ મેળવેલી યોગ્યસિદ્ધિ અને બ્રહ્મજ્ઞાન લોક કલ્યાણ અર્થે અતિ મહત્ત્વના હતા. જે તેમના સેવકોના સુખદુ:ખમાં સહભાગી બની શ્રદ્ધા અને સુખના પૂરક બની રહ્યા.

આજે પણ સદ્ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજ ઉપર શ્રદ્ધા રાખનાર અનેક નર-નારી અબાલ વૃદ્ધ કદી નિરાશ થતાં નથી, તેમની મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે. તેમના પરચા કે જે સત્ય ઘટના બની છે તેમાંના કેટલાક પરચાઓ અમો આ અંકમાં રજૂ કરતાં હર્ષ અનુભવીએ છીએ :-

કેજ્યુઅલની રકમ મળવાનો પરચો

હું વલ્લભવિદ્યાનગર ખાતે રહી એક કંપનીમાં સરવીસ હતો મારા જેવા ઘણા કર્મચારીઓને કંપનીએ છૂટા કર્યા હતા. અને મારે કંપનીમાંથી જે કેજ્યુઅલની રકમ લેવાની નીકળતી હતી તે ઘણા સમયથી મળતી ન હતી. કોર્ટમાં કેસ પણ મુકયો હતો પણ કોઈ નક્કર પરીણામ આવ્યું નહોતું. હું મહદ અંશે આર્થિક મુંઝવણ પણ ભોગવતો હતો !!! તેવામાં એક સવારે બ્રહ્મમુહૂર્તે નિત્યક્રમથી પરવારી સદ્ગુરૂશ્રી ઈમામશાહ મહારાજનું ધ્યાન ધરી મનોમન સંકલ્પ કર્યો કે જો મને કેજ્યુઅલની રકમ મળી જશે તો તે રકમમાંથી મારા મહોલ્લાના દરેક અબાલ વૃદ્ધને લકઝરી બસ દ્વારા ગુરૂદ્વારે દર્શને લઈ જઈશ અને ગુરૂદ્વારે રૂા. ૫૦૧/- જનકલ્યાણ અર્થે ભેટ ધરીશ !!! આવો સંકલ્પ કર્યા બાદ ટુંક સમયમાં જ મને મને કેજ્યુઅલની રકમ રૂા. ૪૫૦૦૦/- મળી !! જે ધાર્યા કરતાં પણ વિશેષ હતી !! મારા તો આનંદનો પાર ન રહ્યો !! જે નિમિત્તે તા. ૨૩-૪-૯૫ના રોજ સંકલ્પ પ્રમાણે અત્રે આવી માનતા પૂર્ણ કરી ઋણ મુક્ત થયો. હું સદ્ગુરૂશ્રીને મારા લાખો દંડવત્ પ્રણામ !!

—ચંપકલાલ મોહનલાલ માછી
(વલ્લભ વિદ્યાનગર)

પોતાની માલીકીનું મકાન ખરીદવાનો પરચો :

સદ્ગુરૂશ્રી ઈમામશાહ મહારાજની અસીમ કૃપાથી મારો પુત્ર સુરત ખાતે રહી સરવીસ કરતો હતો, અને તે પોતાનો મેળે જ પગભર થતો ગયો !! દરેક રીતે સાધન સંપન્ન બન્યો છતાં ભાડાના મકાનમાં રહેતો હોવાથી પોતાનું મકાન ખરીદવાની તમન્ના રાખતો હતો. ઘણી સોસાયટીઓમાં તપાસ કરી પણ કયાંય મેળ પડતો ન હતો !! કંઈક ને કંઈ વિઘ્ન આવી પડતું હતું. તેવામાં તા. ૧૨-૧૧-૯૩ના રોજ ધનતેરસના શુભ દીને સદ્ગુરૂશ્રી ઈમામશાહ મહારાજના સમાધિ સ્થાને દર્શને આવ્યા ત્યાં પુજારીને અમારા દુ:ખની હકીકત જણાવી !! પુજારીએ અમોને આશ્વાસન આપી જણાવ્યું કે આપનું કામ જરૂર સિદ્ધ થશે. આપ કોઈ પણ

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n9/mode/1up

realpatidar.com

સંકલ્પ કરો !! અમોએ ત્યાં ને ત્યાં મનોમન સંકલ્પ કર્યો કે જો અમોને યોગ્ય સોસાયટીમાં વ્યાજબી કિંમતે મકાન મળી જશે તો સદ્‌ગુરૂશ્રીને દર્શને આવીશું !! યથાશક્તિ ભેટ ધરીશું !! આશું !! માત્ર બે-ત્રણ દિવસના ગાળામાં એટલે કે તા. ૧૫-૧૧-૯૩ (ભાઇ-બીજ) ના રોજ સારી સોસાયટીમાં વ્યાજબી કિંમતે સરસ સકાન મળી ગયું અને ટુંક સમયમાં જ એટલે કે તા. ૨૭-૧૦-૯૪ ના રોજ લોન પણ મંજુર થઈ ગઈ !! દસ્તાવેજ વિગેરે પણ થઈ ગયો. આમ થોડીક રકમમાં મારો પુત્ર મકાન લઈ શકયો જે ખરેખર સદ્‌ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજની કૃપાથી જ થઈ શકે !! જે નિમિત્તે અમો તા. ૨૬-૧-૯૫ ના રોજ ગુરૂદ્વારે દર્શને આવી સંકલ્પ પ્રમાણે માનતા પૂર્ણ કરી ઋણ મુક્ત થયો છું. સદ્‌ગુરૂશ્રી અમારા સૌના કોટીકોટી વંદન !!!

—કંચનલાલ જાદવ-ભરૂચ

બિમાર ભેંસ ઉભી થવાનો પરચો :

સદ્‌ગુરૂશ્રી ઈમામશાહ મહારાજની અસિમ કૃપાથી મારે ત્યાં ખેતીલાયક જમીન છે. તેમજ ખેતી હોવાથી તેના પૂરક વ્યવસાય તરીકે ગાય-ભેંસ તો હોય જ !!! થોડાક દીવસ ઉપર રૂ. ૧૨૦૦૦/- આપી ખરીદેલ તાજી દુઝણી ભેસ નિયમિત દુધ આપતી હતી. તેમાંથી ઘર નિર્વાહ સરસ રીતે ચાલતો હતો. તેવામાં ૨૦-૭-૯૫ ના દીવસે સાંજના ચાર વાગે સદર ભેંસ બેસી ગઈ !! ઉઠાડવાના ઘણા પ્રયત્નો કરી જોયા બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા !!! હું પોતે પશુઓનો અડધો ડોકટર તો છું. પણ કોઈ કસબ કામ લાગ્યો નહીં !! ડોકટરને બોલાવી બતાવ્યું, તેમને પણ કોઈ સ્પષ્ટ નિદાન ન આપ્યું !!! અમો તો ઘરનાં સૌ હતાશ થઈ ગયાં કે હવે શું થશે !! ત્યાં તો મેં સદ્‌ગુરૂશ્રી ઈમામશાહ મહારાજને યાદ કર્યા કે સદ્‌ગુરૂશ્રી મારી આ દુઝણી ભેંસ સાજી થઈ હેમખેમ ઉભી થશે તે આપની સમાધિએ દર્શને આવીશ અને શ્રીફળ વધેરીશ તથા શ્રી ઈમામશાહ મહારાજ સંસ્થાનના ગાદીપતિશ્રી કરસનદાસજી મહારાજના ચરણે રૂા. ૫૧/- ભેટ ધરીશ !! રાત્રે આવી રીતે સંકલ્પ કર્યા બાદ સવારમાં ૫-૬ના અરસામાં જાગીને જોયું તો ભેંસ હેમખેમ ઉભી થઈ ઘાસ ખાતી હતી !!! અને થોડીવારમાં ભેંસ દોહી તો બરાબર પહેલાંની જેમ જ દૂધ આપ્યું. ઘરનાં સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં !! હું તો હર્ષઘેલો થઈ સીધો સદ્‌ગુરૂશ્રીની સમાધિએ દર્શને પહોંચ્યો, આચાર્યશ્રીને ચરણે સંકલ્પ પ્રમાણે ભેટ ધરી, સદ્‌ગુરૂશ્રીએ અમારી અરજ સાંભળી સદ્‌ગુરૂશ્રીને કોટી કોટી વંદન !!!

—મંગાભાઈ મોહનભાઈ દરબાર
ગીરમઠા – જી. અમદાવાદ

તબિયત સુધરવાનો પરચો :

સદ્‌ગુરૂશ્રી ઈમામશાહ મહારાજની અસિમ કૃપાથી મારા પુત્ર-પૌત્રો સહ સુખ-ચેનથી જીવન વ્યતિત કરૂં છું. તેવામાં મારા પૌત્રોમાંથી કલ્પેશ ઉ. વર્ષ ૧૪ને ગળાના પાછળના ભાગમાં દુખાવાની ગાંઠ ઉપસી આવી. અમને ઘરનાંને જાતજાતની શંકા-કુશંકા થવા લાગી કે ગાંઠ શેની હશે !! આજુબાજુ દવાખાને નિદાન કરાવ્યું પણ કોઈ નક્કર પરીણામ ન આવ્યું !! ઘરનાં સૌએ નક્કી કર્યું કે કલ્પેશને અમદાવાદ લઈ જઈ નામાંકીત ડોકટરને બતાવવું !!! મારી તો ચિંતા ઓર વધી ગઈ કે દર્દ કેવું હશે !! શું થશે !!! મેં તો ત્યાંને એક ચિંત થઈ દુઃખીયાનાં બેલી સદ્‌ગુરૂશ્રી ઈમામશાહ મહારાજને અંતઃકરણ પૂર્વક યાદ કરી, સંકલ્પ કર્યો કે જો કલ્પેશને કોઈ ભારે દર્દ ન હોય અને નોરમલ રીપોર્ટ આવશે તો હજાર કામ પડતાં મુકી સદ્‌ગુરૂશ્રીની સમાધિએ કલ્પેશને પગે લગાડીશું !! બત્રીસો પ્રસાદ પુજા ધરાવીશું, સવા પાંચ શેર

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n10/mode/1up

realpatidar.com

ધી અખંડ જ્યોતમાં પુરાવીશું અને યથાશક્તિ ભેટ ધરીશું !! આવો દઢ સંકલ્પ કર્યા બાદ કલ્પેશને અમદાવાદ લઈ જઈ રીપોર્ટ લીધા તો રીપોર્ટ બિલકુલ નોરમલ આવ્યા. અને સામાન્ય દવાથી એકંદરે સારૂં થઈ ગયું !! અમારી ચિંતા દૂર થઈ. ઘરમાં તથા સગામાં બધે હાશ થઈ !! જે નિમિત્તે તા. ૨૪–૭–'૯૫ ના રોજ ગુરૂદ્વારે આવી સંકલ્પ પ્રમાણે માનતા પૂર્ણ કરી ઋણ મુક્ત થયાં છીએ, સદ્‌ગુરૂશ્રીને અમારા હૃદય પૂર્વક દંડવત્ કોટી કોટી વંદન !!!

—પેથાભાઈ રા. પટેલ
કલોલકંપા–ખેડબ્રહ્મા

શું શમાવવું છે ?

–લક્ષ્મીબેન આર પટેલ
નાસિક M. S.

આંધિ શમાવવી છે
    તો અંતર સાફ રાખજો
વ્યાધિ શમાવવી છે
    તો શરીર સાફ કરજો
ઉપાધી શમામવી છે
    તો વ્યવહાર સાફ રાખઓ
દુઃખ ભૂલવું છે
    તો કલ્પનામાં રાચજો
આત્માને જાણવો છે
    તો ગુરુ કરજો
જ્ઞાન વધારવું છે
    તો સતૂપંથ જ્યોત વાંચજો
દશમા અવતાર વિષ્ણુભગવાનના દર્શન કરવા છે
  તો પીરાણા નિષ્કલંકી નારાયણુના ધામમાં જજો
કળીયુગનો શ્રેષ્ઠ ધર્મ અપનાવો છે
તો પાળો ઇમામશાહ મહારાજ રચિત સતપંથધર્મ

*

કર વિચાર તો પામ

પ્રવિણ કરશનભાઈ પટેલ, દામાવાસ–ખેડબ્રહ્મા.

* જિંદગી ટુંકી છે અને જંજાળ લાંબી છે માટે જંજાળ ટૂંકી કરશો તો સુખ રૂપે જિંદગી લાંબી લાગશે.
* પગ મુંકતા પાપ છે. જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજનાં દિવસમાં પ્રવેશ કર.
* ચાલ્યું આવતું વેર આજે નિમુંળ કરાય તો ઉત્તમ, નહિ તો તેની સાવચેતી રાખજે,
* પરનિંદા એજ સબળ પાપ માનવુ.
* દુર્જનતા કરી ફાવવું એજ હારવું એમ માનવું.
* વર્તનમાં બાળક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ.
* જગતમાં માન ન હોત તો અંહિ જ મોક્ષ હોત.
* એક ભવનાં થોડા સુખ માટે અનંત દુઃખ નહિ વધારવાનો પ્રયત્ન સત્ય પુરૂષો કરે છે.
* પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ સ્નેહ કરવો યોગ્ય જ છે.
* વાસ્તિવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં.
* ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે અને તે સત્ય પુરૂષનાં ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.
* અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થઈ આત્મ જ્ઞાન રૂપી જીવન–પ્રભાતનો ઉદય થાય તેજ માનવ ભવની સાચી સફળતા છે.

"Lives of great Men all remind us to Nake our lives sublime"

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n11/mode/1up

realpatidar.com

ૐ સત્ય સનાતન સતપંથ ૐ

મનુષ્ય જ્યાં જન્મે છે, તે એની જાતિ કે ધર્મનું પ્રમાણ કહી શકાય નહિ. પછીથી તે ગમે તે ધર્મનો અંગીકાર કરી શકે છે આમ તૃષ્ટિથી ઉત્પન્ન થયેલ મનુષ્ય જીવ ઇચ્છીત વર્ણ માધ્યમથી ધર્મ અપનાવી શકે છે, સર્વ ધર્માણા પરિત્રાણાય સાધુના સમાગતહ ।। તેથી પોતાની આગવી અલૌકિક ઇશ્વરીય શક્તિથી સર્વધર્મના સદ્દગુરૂ બની શકે છે. દા. ત. વિદ્યાલયોમાં અલગ અલગ ચારેય વર્ણોના વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરતા હોય છે. શિક્ષકો પણ ચારેય વર્ણોમાંથી નિમાતા હોય છે તેથી શું શિક્ષણ અપવિત્ર થયું ગણાય ખરૂં ?

તો પછી શ્રી ઇમામશાહ મહારાજે હિન્દુ સંસ્કૃતિને માન, સન્માન આપ્યું હોય, અને તેથી જ ભારતિય સંસ્કૃતિના વિદ્વાનોએ તેમને સદ્દગુરૂનું બિરૂદ આપ્યું હોય, તો શું એ ખોટું કર્યું કહેવાય ?

ફરી એકવાર આધ્યાત્મિક વિચાર વાણી પર આવીએ, આપણા સનાતન ધર્મની અંદર ગાયત્રીનું મહત્ત્વ ઘણું જ ઉંચું આંકવામાં આવ્યું છે. તેથી જ નિજ મંદિરમાં ગાયત્રીનું સ્થાન જાળવી રખાયું છે. જ્યાં મંત્ર, પૂજા, ઉપાસના, જ્યોત વિગેરેની પૂજા એ જ સનાતન ધર્મની જ્વલંત જ્યોત સરિતા સતપંથ.

આ સતપંથ જ્યોત ધર્મને ભારતના તમામ સાધુ સંતો, મંડલેશ્વરો અને પ. પૂ. વંદનિય ધર્મગુરૂઓ, શંકરાચાર્યો શ્રીએ, શુદ્ધતાનું સનાતન ધર્મચક્ર અર્પણ કરી સિદ્ધ કરી બતાવ્યું કે પીરાણા પીઠ સનાતન ધર્મનું અભિન અંગ છે. જ્યાં આદિથી અંત ૐ શબ્દથી નમઃ ૐ નમઃ ની અંદર સમસ્ત બ્રહ્માંડનું પૂર્ણ સનાતન સ્વરૂપ સમાયેલું છે.

ૐ હ્રીં ત્રિગુણાત્મક પ્રકૃતિ–રજ–તજ–તમ –સત્ય, (માયા)

૧ ૐ અત્યાકૃત નિશ્ચય સ્વયં જ્યોતિ સ્વરૂપ'

૨ ૐ સત્યાકૃત, બ્રહ્મ, સગુણ, સાકાર, આધ· નારાયણ,

૩ ૐ અતચિત, આનંદ ધન સ્વરૂપ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ,

૪ ૐ પ્રધાન પ્રકૃતિ,–યોગમાયા આદ્યશક્તિ,–

૧ ત્રિગુણાત્મક રૂપરેખા,

રજોગુણ = શબ્બબ્રહ્મ = પ્રજાપિતા બ્રહ્મા ક ગાંયત્રી તથા મહા સરસ્વતી શક્તિ= જ્ઞાન માર્ગ અષ્ટ દિગ્પાલ ÷ દેવરાજ ઇન્દ્ર, વરૂણ, યમધર્મ, કુબેર. ચિત્રગુપ્ત, અગ્નિદેવ, નૈરૂતિ, મરૂતગણ, અશ્વિનીકુમાર, દેવગુરૂ, બૃહસ્પતિ, અસ્વતુ. ધ્રુવ, ગર , સોમ, આપ, અનિલ.

અનલ, પ્રત્યુષ, પ્રભાષ, તથા અનેક બ્રહ્મવંશી અવતારોની નામાવલી ખુબ જ ધ્યાન ખેંચે છે.

૨. સત્વગુણ–સત્વગુણાધિષ્ઠિત વિષ્ણુ=ભૂદેવી =સૃષ્ટીના ધારણ. પોષણ સંગોપન=ભગવાન શ્રી વિષ્ણુ + શ્રીદેવી = સંરક્ષણાત્મક કાર્ય =અવતાર કાર્ય વિષ્ણુ નારાયણ + મહાલક્ષ્મિ=વૈભવ સમ્પન સૌખ્યમય જીવન દ્વાદશ આદિત્ય ÷ ધાતા અર્યમા મિત્ર, અંશુમન. ભ્રગ, વિવશ્વાન, વરૂણ, ઇન્દ્ર, પૂષા ક્રતુ, ત્વષ્ય, વિષ્ણુ (ચોવિસ અવતાર)

૩. તમોગુણ–શિવશંકર+ સતીપાર્વતી શક્તિ =શિવશક્તિ, મિલન, સમાધિયોગ, મહેશ્વર + મહાદેવી દુર્ગા=પ્રલયકારી મહાશક્તિ, તમોગુણી, રૂદ્ર શક્તિ+મહાકાલી=જગત સંહાર, લયયોગ, આવા આધ્યાત્મિક ગુણોથી સભર ભક્તિમય શૈલીથી તરબોળ સનાતન સતપંથ ધામના કર્ણધાર, વીરવર આચાર્ય શ્રી કરસનદાસજી

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n12/mode/1up

realpatidar.com

મહારાજને સતપંત સમાજના શીષ્યોના કોટી વંદન...

જ્યાં ૐ નમઃથી ગુરૂવંદન ત્યાં મોક્ષ અવશ્ય છે. આવા મોક્ષ માર્ગ જ્ઞાનની (૭) ભૂમિકાના મોક્ષાર્થિ જીવો જગતકાર્યોને કારણે ફરી મૃત્યુ-લોકમા મહાપુરૂષોના અવતારો ધારણ કરી ગુરૂપદ ગ્રહણ કરે છે. આવું જ સત્ય ચમત્કારી ગુરૂપદ વીરવર શ્રીએ મેળવ્યું છે. તેમણે પોતાનું સુખ સતપંથના શિષ્યોને સમર્પણ કર્યું છે, બીજાના સુખ માટે પોતાની સંત ભાવનાને ધર્મયજ્ઞમા હોમી દેનારને ભક્તિસુખ અનાયાસે ઇશ્વરીય કૃપાથી અવશ્ય મળે છે. વીરવર શ્રી એ સંસાર-સુખને કદીએ પ્રાધાન્યતા આપી નથી. ભીતરનું (અંતરનું) આધ્યાત્મિક સુખ મેળવવા માટે જ પ્રયાસો કર્યાં છે, અને તે ઇશ્વરીય ગુણ રૂપ ભૌતિક સુખ ગુરૂશ્રીએ સતપંથ સમાજને ચરણે ધરી દીધું છે.

મિત્રો અંતમાં શિક્ષાપત્રીનું અમૃત આપની સમક્ષ મુક્યું છે તેનું અંતરથી અવશ્ય આચ-મન કરશો. એજ અભિલાષા.

કોઈ પણ પ્રકારની ફળ ઇચ્છા ન રાખતા ગુરૂની સેવા કરવી એ સર્વોત્તમ ધર્મ સાધના છે. ગુરૂસેવા અને ગુરૂ આજ્ઞાનું પાલન આવનાર બધા જ પ્રકારની આપત્તિઓ સહન કરવાની હિંમત ધરાવે છે એ જ પોતાના પ્રાકૃત સ્વભાવને જીતી શકે છે.

લેખન અને સંકલન,
રતિલાલ બી. રાવળ,
(ખેડોઈ) કચ્છ.

ADVERTISEMENT

The complete vacation in the Pennsylvania Dutch country
-U. S. A.

* Econo Lodge North/South on U. S. Hwy 30, East, Lancaster PA/7602, Call for reservation 011-717-299-6900 Or 001-717 -397-1900.
* Days Inn East on RTE 896 North, Ronks, PA 17572, Call for reservation 011-717-390-1800.
* Knights Inn on RTE 13 South, New Castle, DE 19720, Call for reservation 001-302-328-6691.
* Capri Motel 2540 w 8TH. St. Erie PA. 16505 011-814-838-2081

realpatidar.com

realpatidar.com

જે માબાપો પોતાનાં છોકરાંઓને ઈશ્વરી જ્ઞાન આપવાની મહેનત કરતાં નથી તેઓ તેમનુ બહુજ બૂરૂ કરે છે.

–રાજેશકુમાર નાનજીભાઈ રૂડાણી (નાના અંગીયા–કચ્છ)

ઇશ્વરી જ્ઞાન એ કેટલી બધી ઊંચી વાત છે તે ઘણા માણસો જાણતા નથી, તેથી એ જ્ઞાન ફેલાવવાની બાબતમાં માણસો બેદરકાર રહે છે. જંગલી માણસો એવી ભૂલ કરે તે જુદી વાત છે, પણ અમે જોયું કે સારા ગણાતા માણસો પણ આવી બાબતમાં બેદરકારી રાખે છે. અને પોતે પોતાના નિયમો પ્રમાણે વર્ત્યા કરે છે; પણ પોતાનાં છોકરાઓમાં એ જાતનું જ્ઞાન વધારવા માટે કાંઈ પણ ખાસ મહેનત લેતા નથી; એમ કરવું એ ઘણું જ ખરાબ છે એ માટે તાળી લાગેલા ભક્તો કહે છે કે.

કોઈ છોકરું માબાપની ભૂલથી પડી જાય તેને લીધે તે લુંલું થઇ જાય કે લગડું થઈ જાય, અગર માબાપની બેદરકારીને લીધે બચ્ચાનો મંદવાડ વધી જાય અને તેમાંથી તે આંખે આંધળું થાય, કાણું થાય કે બહેરું થાય અગર બીજી કોઇ જાતની શરીરની ખોડખાંપણ વાળું થાય, એ જેટલું ખરાબ છે, તે કરતાં પણ પોતાનાં બાળકોને અજ્ઞાન રાખવા, અભણ રાખવાં અને મૂર્ખ રાખવાં એ વધારે ખરાબ છે.

કારણ કે અજ્ઞાનપણને લીધે જ તેઓની આખી જિંદગી દુઃખમાં જાય છે, આજ્ઞાનપણાને લીધે જ તેઓ ઘણી જાતનાં પાપમાં ફસાઈ જાય છે અને અજ્ઞાનપણાને લીધે જ તેઓ માનસિક આનંદ ભોગવી શકતાં નથી તથા બુદ્ધિબળનો આનંદ પણ ભોગવી શકતાં નથી, તેથી તેઓનું સુખ બહુજ ટુંકી હદમાં આવી જાય છે માટે પોતાનાં બાળકોને અજ્ઞાન રાખવાં એ તેઓની જિંદગી બગાડી નાખવા જેવું છે. પણ યાદ રાખજો કે. પોતાનાં બાળકોને ઇશ્વરી જ્ઞાન વિનાનાં રાખવાં એ તો તેઓને ભણાવી ગણાવી પરણાવી, મોજમજા કરાવી ને નરકમાં મોકલવા જેવું જ છે. કારણ કે જે માણસમાં ઇશ્વરી જ્ઞાન ન હોય તેને નરકમાં જવું જ પડે એમાં કાંઈ નવાઇ નથી; માટે પોતાનાં બાળકોને ઇશ્વરી જ્ઞાન ન આપવું એ બહું જ ખરાબ છે. કારણ કે ઇશ્વરી જ્ઞાન વિનાના માણસોની જિંદગી સત્ત્વ વિનાની હોય છે. ઇશ્વરી જ્ઞાન વિનાના માણસોની જિંદગી પોલવાળી હોય છે, ઇશ્વરી જ્ઞાન વિનાના માણસોની જિંદગી દુઃખી હોય છે. ઇશ્વરી જ્ઞાન વિનાના માણસોની જિંદગી લોભ અને લાલચોથી ભરેલી હોય છે, ઇશ્વરી જ્ઞાન વિનાના માણસોની જિંદગી ઉંચી જાતના હેતુઓ વિનાની હોય છે, ઇશ્વરી જ્ઞાન વિનાના માણસોની જિંદગી એક જાતની તેજી વિનાની હોય છે. ઇશ્વરી જ્ઞાન વિનાના માણસોની જિંદગી પાપ તરફ વળે તેવી હોય છે. અને ઇશ્વરી જ્ઞાન વિનાના માણસોની જિંદગી અંધકારવાળી હોય છે. એવી અધમ જિંદગીમાં પોતાનાં બાળકોને રાખી મૂકવા અને નરકમાં યમદૂતોના હાથમાં તેઓને સોંપવાં, એ શું મોટામાં મોટી ભૂલ નથી ? એ શું ભયંકર ગુનો નથી ? અને એ શું પોતાનાં બાળકોની મોટામાં મોટી ખરાબી નથી ? બંધુઓ ! આવી ભયંકર ખરાબીમાં ન રહી જવાય માટે તમારાં બાળકોને જેમ બને તેમ સાચામાં સાચું ને ઊંચામાં ઊંચું, આ જિંદગી સુધરે તેવું ઇશ્વરી જ્ઞાન આપવાની કોશિશ કરજો, ઇશ્વરી જ્ઞાન આપવાની કોશિશ કરજો ! □

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n14/mode/1up

realpatidar.com

[૧૧]

'ગુરૂપૂર્ણિમા' નો મંગલમય પ્રસંગ

—સી. એસ. પટેલ
વડાગામ S.K.

શ્રી સતપંથ પ્રેરણાપીઠ પીરાણા શુભ સ્થળે તા. ૧૨-૭-૯૫ ના શુભ દિવસે સદ્દગુરૂશ્રી ઇમામશાહ મહારાજની અસીમ કૃપાથી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ગુરૂપૂર્ણિમાનો મંગલમય પ્રસંગ પ. પૂ. વિરવર આચાર્યશ્રી કરસનદાસજી મહારાજની પ્રેરણાથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો, શુભ પ્રભાતે સૌ પ્રથમ પ. પૂ. વિરવર આચાર્યશ્રી કરસનદાસજી મહારાજે પરમગુરૂશ્રી ઇમામશાહ મહારાજની પાદુકાનું ચરણામૃત લઇ ચંદન તિલક, અને પુષ્પથી વધાવી પુજન કર્યું, જેમાં આરતી અને ગુરૂ મહીમાના પદોના ગાનથી સંસ્થાના અન્ય સાધુ સંતો તેમજ ધર્મપ્રેમી ભાઇ-બહેનો અને ભુલકાંઓએ હર્ષભેર ભાગ લીધો હતો.

ત્યાર બાદ સૌ ભાવિક ભક્તોએ પ. પૂ. વિરવર આચાર્યશ્રી કરસનદાસજી મહારાજનું પુજન-અર્ચન કરી, આરતી ઉતારી, સૌ ભક્તોએ પોતાના જીવનની ધન્ય ઘડી માની હતી. સ્ટેજ પર બિરાજમાન સાધુ-સંતો અને મહાનુભાવોએ ગુરૂપૂર્ણિમાનો પ્રસંગ અને ગુરૂ મહીમાને અનુરૂપ ઉદ્દબોધન કર્યાં હતાં, આવા સતસંગ ભર્યા વાતાવરણમાં સૌ પ્રભુમય બની ગયાં હતાં. શિષ્યનો ગુરૂ પ્રત્યેનો આદર અને ગુરૂનો શિષ્ય ભાવ અહીં અમિમય વાદળી બનીને રહ્યો હતો. આમને સામને સૌ હર્ષોલ્લાસથી હર્ષનાં આંસુ વહાવી રહ્યાં હતાં ત્યારે આ શ્લોકની પ્રતિતી થઇ રહી હતી કે " ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા, ગુરૂ સાક્ષાત્ પરિબ્રહ્મા-તસ્મયે શ્રી ગુરૂદે નમઃ ।"

સદ્દગુરૂશ્રી ઇમામશાહ મહારાજના ગુરૂદ્વારથી થોડેક દૂર " ફુલવાડી " નામે પ્રચલીત સ્થળે સંતશ્રી રામદાસ બાપુનુ સ્મૃતિ ધામ આવેલું છે. ત્યાં તેમના શિષ્ય મંડળે ગુરૂપૂર્ણિમા નિમિત્તે મહાપુજાનો કાર્યક્રમ શ્રી નાનકદાસજી મહારાજના વરદ્ હસ્તે રાખવામાં આવ્યો હતો. જેમાં પૂ. રામદાસ બાપુના શિષ્ય મંડળ સાથે અનેક ભાવિક ભકતોએ હર્ષભેર ભાગ લીધો હતો. આ શુભ પ્રસંગે U.S.A. થી સંતશ્રી પ્રેમદાસ બાપુએ હાજરી આપી ગુરૂ મહિમાનું વિગવવાર વર્ણન કર્યું હતું.

ઉપરોક્ત પ્રસંગે કચ્છ, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા, ખેડા, રાજપીપળા, વડોદરા, સુરત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા દૂર દૂરના પ્રદેશોથી સતપંથ સંપ્રદાયના અનુયાયીઓએ હજારોની સંખ્યામાં આવીને આ શુભ પ્રસંગે લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.

આ મંગલમય પ્રસંગે પધારેલ તમામ યાત્રાળુઓને નીચેના દાતાઓ તરફથી બ્રહ્મ ભોજન આપવામાં આવ્યું હતું.

તા. ૧૧-૭-'૯૫ના સાંજના દાતાશ્રી રાજાભાઇ લાલજીભાઇ પટેલ, અમરગઢ-મોડાસા-S.K.

તા. ૧૨-૭-'૯૫ના બપોરના દાતાશ્રી દાનાભાઇ વાલજીભાઇ પટેલ, શીવપુરા-મોડાસા-S.K.

આવા બ્રહ્મ ભોજનના દાતાઓ, આયોજકો, સ્વયં સેવકો અને કર્મચારીઓના અથાગ પરિશ્રમથી આ પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો હતો.

□

realpatidar.com

realpatidar.com

પત્રથી પ્રતિસાદ

—જયંતિ પ્રે. પટેલ, લક્ષ્મીપર (કચ્છ)

પ. પૂ. વંદનીય વિરવર આચાર્યશ્રી કરસનદાસજી ગુરુમહારાજ તથા દાદાશ્રી શામજીદાદા તથા સતપંથ સમાજ સર્વેને મારા જય નિષ્કલંકી !

સહર્ષ જણાવવાનું કે ઘડાણી ગામમાં " તમારે દ્વારે " શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મેં આનંદથી ભાગ લીધો. તેના પહેલાં અમારા ગામના વડીલ નારણબાપાએ આઠ દિવસ પહેલાં વાત કરી કે ઘડાણી ગામમાં શિબિર થવાની છે. અમો આનંદમાં આવી ગયા. તથા અમો દિવસો ગણવા લાગ્યાં. અને એ દિવસ આવી ગયો. અમે ઘડાણી ગામમાં ગયા. ખૂબ જ આનંદ આવી ગયો. શિબિરમાં અમો બાળકો જુઠું બોલતાં હતાં તે પણ ભૂલી ગયાં. અમારાં શિબીરાથીંના દાદા તો, છે. પણ શામજી બાપા હવેથી આપણા સર્વેના લાડીલા દાદા છે. વિનંતી–ગુરુમહારાજ તથા દાદાશ્રીની અમૃત વાણીનો મને લાભ લેવો છે તો તમો જેમ થાય તેમ તમારી અમૃત વાણીનો એક મોટો પત્ર લખજો.

ગુરુ વદના

જયંતિલાલ પ્રે. પટેલ લક્ષ્મી પર–કચ્છ.

ગુરુના યાદ પંકજમાં નમાવુ શીષ સદ્ભાવે
અંખડજ્યોતિ જગાવીને, તપો ભૂમી તમે સ્થાપી
પ્રતિષ્ઠા નિષ્કલંકીની, પીરાણા, ધામમાં કીધી....
.... ગુરુના.
કરી વ્હેતી તમેં વિદ્યા, પ્રમાણીતસાસ્ત્રમાં સર્વે,
પીરાણાં ધામનો મહિમાં, વર્ધાયો, યુગ વિષે આજે
......ગુરુના.
અખિલ ભારત વિષે, આજે ગુંજે છે વેદના મંત્રો,
હવન સુવાસથી મહેકે, દીશાઓ દેશની સરવે.
ગુરુના યાદ પંકજમાં, નમાવું શીષ સદ્ભાવે,

પ. પૂ. પરમ વંદનીય વિરવર આચાર્ય શ્રી કરશનદાસજી ગુરુ મહારાજ તથા દાદા શ્રી શામજી દાદા તથા સતપંથ સમાજ સર્વેને મારા જય નિષ્કલંકી પાઠવશો !

સહર્ષ જણાવાનું કે તમોએ મોકલેલ ચોપડીઓ " સતપથ વચના મૃત બિન્દુ, સતપંથ નિત્ય પ્રાર્થના પાઠ અને ફોર્મ " મળી ગયું છે. તો તે જાણસો. બીજું અમો બાળકો સર્વે નિયમિત ચોપડીઓનું સારી રીતે પઠન કરીએ કરીએ છીએ. અમો નિયમિત મંદિરમાં જઈ આરતી–નારાઓ બોલીએ છીએ. અને સર્વે જનો સાંભળવા લીન બની જાય છે. આવા ભાવ પૂર્વક પ્રેમનો વરસાદ વરસાવતા રહેશો. અમો દર "રવિ" વારના શિબીર યોજીએ છીએ. શિબીરમાં અમારા વડીલ સાહેબ શ્રી નારણ બાપા પણ હાજરી આપે છે.

અંખડ જયોત જેમ અજવાળા આપે છે તેમ આપની અમૃત ભરેલી વાણી અમારા હૈયામાં વસી અમારા હૈયાને આનંદ આપી રહે છે તો આપની આવી અમૃત વાણીનો લાભ લેવા રાહ જોઈએ છીએ તો આ પત્ર મોકલતાં તમારા અમૃત ભરેલ પત્રની જરૂર રાહ જોવા ઇચ્છીએ છીએ. બસ એજ.

–વનીતાબહેન પી. પટેલ
લક્ષ્મીપુર (નેત્રા) કચ્છ

પરમ વંદનીય આચાર્ય શ્રી કરશનદાસ મહારાજ અને પૂજ્ય શામજીદાદા તેમજ અન્ય સતપંથી જનોને અમારા નમસ્કાર !

સહર્ષ જણાવાનું કે ગોતા કંપામાં " શિબિર તમારે દ્વારે " એ કાર્યક્રમ યોજાયો. તેમાં ખૂબ મઝા આવી. તેમજ શામજીદાદા એ પોતાનો અમૂલ્ય સમય લઈને તેમજ કષ્ટ વેઠીને બધા

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n16/mode/1up

realpatidar.com

ગામોમાં શિબિરનું આયોજન કર્યું. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

બીજુ જે આપ બે ચોપડી તૈયાર કરવાનું કીધું છે. તે અમો દિવાળી સુધી ચોક્કસ તૈયાર કરી દેશું. બીજુ અમારા ગામમાં દર બુધવારે શિબિર યોજાય છે. શાંતિ દાસ મહારાજ અને શાંતિભાઈ એમ બે સાહેબ શિબિરનું આયોજન કરે છે. અને અમે પરમ વિશીષ્ટનો સિક્કો પ્રાપ્ત કરીશું જ. એવી ખાતરી આપીએ છીએ. બીજું અમારા ગામના વડીલો અને યુવાનો શિબિરમાં ઉત્સાહથી ભાગ લે છે.

વિવિધ ભાષામાં તમારું નામ શું છે?

–પ્રકાશ એમ. પટેલ બારસોલ (ખેડબ્રહ્મા)

(૧) ગુજરાતી – તમારું નામ શું છે?
(૨) હિંદી – તુમ્હારા નામ કયા હૈ?
(૩) મરાઠી – તુમચે નાંવ કાય આહે?
(૪) શીખ – થાડો નામ કી હૈ ગા?
(૫) સિંધી – તુંઝા નાલા છાય?
(૬) ઉર્દૂ – આપકા ઇસ્મે શરીફ કયા હૈ?
(૭) કારવાડી – તબલે નાંવ ઇત્તે?
(૮) વરાડી – તુહ નાંવ કાય બહય?
(૯) કચ્છી – તોજો નાલો કુરો આયે?
(૧૦) ચિત્યાવની – તુઝાં નાંવ કીતાં?
(૧૧) કોંકણી – તુઝે નાંવ કીત્તે?
(૧૨) નાગપુરી – તુઝાં નાવે કાય આહે?
(૧૩) અંગ્રેજી – વોટ ઇઝ યોર નેમ?
(૧૪) સંસ્કૃત – તવ નામ ભેયં કિમસિ?
(૧૫) મારવાડી – થારો નામ કે હૈ?
(૧૬) ભાવસારી – તારું નામ શુસ?
(૧૭) કન્નડ – નિંમી હેસરું એનું?
(૧૮) મદ્રાસી – ઉગલ ૩ડોમ પેર અન્તા?
(૧૯) નેપાલી – તીમરો નાંઉ કયા થે?
(૨૦) ખાનદેશી – તુન્હે નાંવ કાય સે?
(૨૧) મલયાલમ – એંન્હા પેરે?
(૨૨) આરબી – શુ આધા સુરમાક?

સતપંથ સંપ્રદાયનું ધાર્મિક પ્રેરણા આપતું માસિક 'સતપંથ જ્યોત' પ્રગટ કરવા બાબત–શુભેચ્છા પત્ર

આશરે ૫૦૦ વર્ષ પહેલાં સદ્ગુરુશ્રી ઇમામશાહ મહારાજે સ્થાપેલ આ સંસ્થા આજે પણ કાર્યરત છે. આપણા વડિલો જેને પેઢીની પેઢીથી અનુસરી રહેલ હતા. સતપંથને માનીને આજે પણ આપણે ભગવાનના સૃષ્ટિ ઉપર નવ અવતાર થઇ ચૂકેલા છે. હવે દશમાં અવતાર "શ્રી નિષ્કલંકી નારાયણ"નો થશે. જેનું પ્રમાણ આપણને સદ્ગુરુજીએ સુચવેલું છે.

આજ પર્યંત સતપંથ પ્રચાર નહિવત હતો. હવે તેમાં જાગૃતિ લાવવી જોઇએ. હાલમાં સંદેશ "ધર્મસંદેશ" રાજકોટ પ્રેસ "જલારામ જ્યોત' પ્રસિદ્ધ કરી રહેલ છે. તે મુજબ આપણે પણ કોઇ ધાર્મિક માસિક ચાલુ કરવાની આવશ્યક્તા છે. આ બાબતે મેં પીરાણાના ગાદીપતી શ્રી કરસનદાસજી મહારાજ અને ફૈજપુર (મહારાષ્ટ્ર) ના પૂ. જગન્નાથજી ઉપરાંત બરોડાના શ્રી નાથુભાઇ જાદવ ઉપર પત્રો લખેલા કે રૂબરૂમાં ચર્ચાવિચારણા કરેલી. ગુરુજીની કૃપાથી જે સ્વપ્ન સિદ્ધ થયું છે. સતપંથ જ્યોત વાંચી મને ઘણો આનંદ થાય છે.

પૂ. જગન્નાથ મહારાજે મારી ઉપર ઘણા પત્રો લખેલા કે તમે ધાર્મિક માસિક પ્રગટ કરવા વિશેષ રસ લઇ રહ્યા છો. તમારી મનોકામના ઇમામશાહ મહારાજ જરૂર પૂરી કરશે જ. આજે તે મનોકામના પૂર્ણ થયેલી સમજું છું. દરેકના ઘરે "સતપંથ જ્યોત' હોવું જરૂરી છે. દરેકે અવશ્ય મંગાવવું અને વાંચવું જોઇએ.

—સુખલાલભાઇ ગોપાલ પટેલ
(ભીમપોર–સુરત)

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n17/mode/1up

realpatidar.com

" આવો આપણે સુખમય સંસારનું નિર્માણ કરીએ"

–રતિભાઈ એમ. પટેલ, પટેલ સો મીલ, હરણી વડોદરા

માનવીના જીવનનો ઉદ્દેશ સુખમય જીવન જીવવાનો છે. સુખમય સંસાર ત્યારે જ શકય બની શકે જ્યારે આપણા બધામાં સર્વ મંગલ ભાવના ઉત્પન્ન થાય. 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવનાનું નિર્માણ કરવા માટે આપણે એટલું સમજી એ કે આપણે બધા પરમાત્માના સંતાનો છીએ. ને આપણા બધાનો પરમાત્માના સંતાન તરીકેનો સંબંધ ભાઈ–ભાઈનો છે. ભાઇ–ભાઇ તરીકે આપણું એક વિશાળ કુટુંબનો અર્થ એક બીજાને પ્રેમ આપવો. એકબીજા પ્રત્યે સદ્દભાવના કેળવવી, સન્માન આપવું ને પારસ્પરિક શાંતિ નો વ્યવહાર કરવો.

જગતનો ક્રમ છે, નિયમ છે કે સન્માન આપનાર ને સન્માન મળે છે ને પ્રેમ આપનાર ને પ્રેમ દ્વેષ કે તિરસ્કાર આપવાથી બદલામાં દ્વેષ અને તિરસ્કાર જ મળે છે. જેટલું આપીશું તેટલું સામું મળશે. આપવાનો અર્થ લેવાનું છે, મળવાનું છે. જીવનમાં મિત્રતા જ મહત્ત્વની છે. મિત્રતાની ભાવના રાખવાથી કેટલો બધો ફાયદો થાય છે. બીજા સાથે હાથ મિલાવી તો જુવો કેટલો બધો આનંદ થાય છે. બીજાને નુકશાન કરવું કે બીજાનો નાશ કરવો કે બીજાને ખતમ કરવો આ માનવીનું કાર્ય નથી. આપણે એવું કામ કરવું જોઈએ કે જેનાથી બીજાને શાંતિ મળે. શાન્તિ માટે આત્માત્મિકતા ને ધર્મનો અર્થ મળ્યો છે. દિવ્ય ધારણા જ જીવન છે. કહેવાય છે કે ધર્મ જ ઉપકાર છે. બીજાના ઉપકારમાં પોતાનો પણ ઉપકાર રહેલો છે.

આવો! આપણે બધા સાથે મળી દેશ, સમાજ, કુટુંબ મિત્રમંડળ સંબંધીઓને શાંતિ મળે તેવું ઉમદા કાર્ય કરીએ. માનવી પોતાના સંઘર્ષો, માનસિક તાણ વગેરેમાંથી મુક્ત અને તેવી પ્રાર્થના કરીએ ને સુખમય સંસારના માટે શાંતિનો દિપ પ્રજવલિન કરીએ.

ૐ શાંતિ શાંતિ શાંતિ

"ભગવાનના ચમત્કારને અનુભવો"

—જ્યોત્સ્ના સી. પટેલ, ઈશ્વરપુરા–ઇડર

ઘણા લોકો મોટા મોટા દેશોમાં જાય છે. અને ત્યાં મોટી–મોટી ઇમારત જોઈને કહે છે. વાહ! આ આટલી ભવ્ય હજારો માળાની બિલ્ડિંગ કોણે બનાવી હશે? એ ઘણો મોટો એન્જીનિયર હશે. આપણે ઘણું આધુનિક મશીન જોઈએ છીએ તો કહીએ છીએ. વાહ! કોણે આ મશીન બનાવ્યું હશે? આપણે ઘણી બધી વસ્તુ જોઈએ છીએ તો મનમાં વિચાર આવે છે કે ખરેખર આને બનાવનાર કોણ હશે? જરૂર કોઈ મોટો ઇજનેર હશે.

પરંતુ અફસોસની વાત એ છે કે માનવ શરીર જે સંસારમાં ચમત્કારિક સૌથી વધુ જાદુ ભરેલું છે. તેને બનાવનાર તરફ ઇશારો કરતાં નથી. અરે મુર્ખ માનવ! જેને તને બનાવ્યા. એક એવી મશીનરીને બનાવી જે બોલી શકે છે. જે વિચારી શકે છે. સાંભળી હરી–ફરી શકે છે તેની તરફ કોઈ જ ઈશારો કરતા નથી. કોઈ એમ નથી કહેતું કે ભગવાનનો કેવડો મોટો ચમત્કાર છે. થોડી માટી લીધીને એક પ્રતિમા ઉભી કરી અને તે પ્રતિમા બોલવા લાગી. કેટલો મોટો ચમત્કાર છે!

બાઇબિલમાં આવે છે કે ભગવાને માણસને માટીમાંથી બનાવ્યો. ધરતીની માટીમાંથી બનાવ્યો. તેના નાકની અંદર એક ફૂંક

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n18/mode/1up

realpatidar.com

મારી અને તે માટીનું પૂતળું જીવતો જાગતો આત્મા-માનવ બની ગયો. કેટલો મોટો ચમત્કાર Mildele છે. કે ભગવાને માટી ઉપાડી અને ફૂંક મારી અને જે માટી હતી તે બોલવા લાગી. વિચારવા લાગી. અને હલન ચલન કરવા તથા સાંભળવા લાગી. શું કમાલ છે તે ખુદાની-પ્રભુની ! પરંતુ અફસોસ છે કે એવું ક્યારેય વિચારતા નથી. એ આપણું દુર્ભાગ્ય છે તો સંતો આપણને ઝટકો મારે છે. આપણે જે રૂઢિવાદનાં પાંજરામાં જકડાયેલાં છીએ તેને સંતો ખોલી નાખે છે. અને કહે છે ભગવાન, તે સર્વ શક્તિમાનની સત્તાને ઓળખો આપણે વિવશ થઈ સ્વીકારવું જ પડશે કે આ સૃષ્ટિની (રચના) પાછળ કોઈ મહાન શક્તિ કાર્ય કરી રહી છે. બસ એજ શક્તિનું નામ ઇશ્વર છે. [અસ્તુ]

ભજન

ભાવનાબેન: આર. પટેલ મેત્રાલકંપા (ખેડબ્રહ્મા)

રંગ ચડયો કદી નવ ઉતરે રે,
એમ કહી ગયા દાસ કબીર....રંગ
રંગ ચડયો ઇમામશાહ ગોરનો રે,
એતો કરશે અનંતોના કામ....રંગ
નવા નગરની નવી રીત છે રે,
મારા વાલાની પ્રેરણા પ્રીત...રંગ
વાત વાતમા બોલો વિવેકથી રે,
નામ લીયોતો બેડા પાર છે રે....રંગ
તપ કરીએ તો પદમી પામીએ રે,
એવી નિતિની કરીએ વાત....રંગ
દાન કરી ઓતો ખુલ્લા દિલથી રે,
દયા છે ધર્મનું મુળ ....રંગ
સાચા સંતોની સંગે શોભીએ રે,
એની વાણીનો લઈ એ લાભ....રંગ
ગાય હરિ તો પુરણ પ્રેમથી રે,
મારા સંતોને વૈકુંઠ વાસ....રંગ
બોલ્યા ગુરૂ ઇમામશાહ રે,
બોલ્યા ગુરુનો જયજય કાર...રંગ

*

દયાળુ કઠિયારો

પ્રદીપ કે. પટેલ નાસિક
હરેશ બી. પટેલ

એક મોટું જંગલ હતું, જંગલમાં એક કઠિયારો ઘણા વખતથી એક ઝુંપડી બનાવીને રહેતો હતો તેને પાંચ વરસનો ભોલો કરીને એક દીકરો હતો.

ભોલાના જન્મ બાદ તેની માતા સ્વર્ગે સિધાવી હતી. એટલે ભોલાનો બાપ પોતાનું લાકડા કાપવાનું કામ જ્યારે કરતો ત્યારે નાનકડા ભોલાને પોતાની સાથે લઈ જતો કોઈ ઝાડની ડાળીએ પોતાનું પનીયાનું ઘોડિયું બાંધીને ભોલાને તેમાં સુવડાવતો અને પોતે લાકડા કાપતો અને લાકડાનો ભારો બાંધીને બાજુના ગામમાં તે વેચવા જતો ત્યારે ભોલાને સાથે જ લઈ જતો. કારણ કે જંગલમાં એકલો ભોલો કોની પાસે રહે?

એક દિવસ સાંજના સમયે કઠિયારો લાકડાનો ભારો વેચીને ગામમાંથી શાક-સિધુ લાવીને જંગલમાં ઝુંપડીએ રસોઈ કરવા લાગ્યો. રસોઈ કરતી વખતે પણ ભોલાને જોડે સુવડાવ્યો રસોઈ તૈયાર થઈ ગઇ એટલે જમવાની તૈયારી કરી. એક મસ્ત ફકીર આવ્યો અને કઠિયારાએ ફકીરને આશન આપીને બેસાડયો શાક-રોટલી બનાવી હતી. તો ધરી, ફકીરતો આ ગરીબ કઠિયારાની પરોણાગત માણીને આનંદમાં આવી ગયો રાતે સુવા માટે સુંદર ઘાસની પથારી કરી આપી ફકીરના પગ પણ દબાવ્યા અને સુઇ ગયો.

બીજા દિવસે સવાર પડી ત્યારે ફકીરે કહિયારા પાસે જવાની રજા માગી ત્યારે કઠિયારાએ ફકીરને સાંજ સુધી રોકાઈ જવા વિનંતી કરી અને પોતે જંગલમાં જઈ લાકડા કાપી આવે ત્યાં સુધી ભોલાને સાચવવાનું કામ ફકીરને આપ્યું.

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n19/mode/1up

realpatidar.com

"ભલે ભાઇ તું જંગલમાં લાકડા કાપીને જલદી આવજે હું ભોલાને સાચવીશ, અને પાછો ભારો તું ગામમા વેચીને જ આવજે. ભોલાની જરાય ચિંતા ના કરીશ" ત્યારે કઠિયારાએ ખૂશ થઈને બાબા ફકીરને કહ્યું, "આજે તમારા માટે ગામમાંથી મિઠાઈ લેતો આવીશ પરંતુ મારા ભોલાને સાચવજો." આટલું કહી કઠિયારો જંગલમાં ગયો, પછી આનંદથી ભોલો અને ફકીર મજા કરતા હતા. ફકીર પોતાના થેલામાંથી વસ્તુઓ, કાઢીને ભોલાને બતાવતો હતો.

કઠિયારો લાકડાનો ભારો લઈ ગામમાં આવ્યો અને તે વેચીને બજારમાં જઈ મિઠાઈ લીધી. અને ઉતાવળે પગે જંગલમાં જવા લાગ્યો. કારણ કે સવારથી ભોલાને ફકીર પાસે મૂકીને આવ્યો હતો. ગામ બહાર નીકળ્યો ત્યાં રસ્તામાં એક ડોશીમા મળ્યા. તેણે કઠિયારાને જોઇને ભીખ માગી "બેટા હું ચાર દિવસથી ભૂખી છું. હવે તો એક ડગલું ચાલી શકાય તેમ નથી. કંઇક ખાવાનું હોય તો આપો. ભગવાન તારા ભર્યા ભંડાર રાખશે કઠિયારો માયાળુ હતો હતો ડોશીમાનું વચન સાંભળી મિઠાઈનું પડીકું આપી દીધું, ડોશીમા એ મીઠાઈ ખાઈ ને પ્રેમથી આશીર્વાદ આપ્યા માનવી જો સાચા ભૂખ્યાને ખવડાવે તો તેના જેવું કોઈ પુણ્ય નથી.

કઠિયારો જંગલમાં આવ્યો. જ્યાં પોતાની ઝુંપડી હતી ત્યાં શું જોયું? જબરો સાત માળનો મહેલ ઊભો હતો. સૈનિકો મહેલની ચોકી કરતા હતા કઠિયારો તો ઘડીભર વિચારમાં પડી ગયો કે મારી ઝુંપડી ક્યાં? મારો ભોલો અને ફકીર ક્યાં? હું ભૂલો તો નથી પડયો ને? આજુબાજુ જોવા લાગ્યો. આંખમાંથી આંસુ વહી રહ્યા હતા ત્યારે એક સિપાઈએ આવીને કહ્યું. "તમને મહેલમાં બોલાવે છે." પણ ભાઇ આ મહેલ કોનો છે? મારી ઝૂંપડી અહી હતી. અને મારો ભોલો." આટલું બોલતાં બોલતાં તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. "તમે શાંતી રાખો બધુ સારું થશે તમે મહેલમાં ચાલો. કઠિયારો મહેલમાં આવ્યો. પરંતુ કઠિયારાનું મનતો ભોલાને શોધવામાં હતું. એમ કરતાં સાતમો માળ આવી ગયો. ત્યાં ભોલો સોનાની ખાટ ઉપર રાજના કુવર જેવો બનીને બેઠો હતો ભોલો તો, "બાપુ...બાપુ..." કહીને બે હાથ ઊંચા કરતો હતો. પહેલી નજરે તો કઠિયારો ભોલાને ન ઓળખી શકયો.

ત્યાર બાદ મંત્રીએ કઠિયારાને બધી વાત કરી "જૂઓ ભાઇ તમે જે ફકીરને ભોજન આપ્યુ હતું તેનું આ ફળ છે. ભગવાન પોતે જ ફકીરના રૂપમાં આવ્યા હતા અને જે ડોશીમાને બધી મિઠાઇ આપી દીધી હતી તે ડોશીમા લક્ષ્મીજી હતા અને લક્ષ્મીજીએ ખુશ થઈને આ બધું. તમારા માટે કર્યું છે. આજથી તમે મહેલનાં માલિક છે.

કઠિયારો તો આ વાત માની ન શકયો પરંતુ જેણે ભૂખ્યાને ભોજન આપ્યું છે. તેને ભગવાન જરૂર ફળ આપે છે. ત્યાર બાદ કઠિયારો જીવનભર સુખી રહો. અને સદાવ્રત ખોલ્યું જે કોઈ આવે તેને જમાડયા વગર જવા નાદે, ભોલો પણ હવે ઉંમર લાયક થયો હતો તે પણ સેવાભાવી હતો. આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે ભગવાન કયા વેશમાં કયારે આપણાં ત્યાં આવે છે તે સમજાતું નથી. આપણું કયારે દુઃખ-દરિદ્રય દૂર કરે તે ખબર પડતી નથી માટે મારા વહાલા બાળમિત્રો આપણે પણ ગરીબ ભૂખ્યાની સેવા કરવી જોઈએ.

પટેલ પ્રદીપ કરમીશભાઈ
૨, જ્યોતિપૂજા સોસાયટી,
ટકલેનગર,
પંચવટી,
નાસિક-૪૨૨૦૦૩

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n20/mode/1up

realpatidar.com

—: ૐ શ્રી નિષ્કલંકી નારાયણ નમઃ—

પ. પૂ. વિરવર આચાર્યશ્રી કરસનદાસજી મહારાજના શુભ આશીર્વાદથી શ્રી સતપંથ બાલ–બાલિકા સુસંસ્કાર શિબિર તમારે દ્વારે કચ્છ –ગુજરાતના ૨૧૫ જેટલા ગ્રામ્ય વિસ્તારમાં વેકેશન વિઝિટ કાર્યક્રમ દરમ્યાન શિબિરાર્થી બાલ–બાલિકાઓએ મંત્રો કંઠસ્થ કરેલા હતા. તેની સમિક્ષાનો વિગતવાર હેવાલ અત્રે રજુ કરતાં હર્ષ અનુભવું છું આટલા ટુંકા ગાળામાં બન્ને શિબિરમાંથી જે આ નોંધપાત્ર પ્રગતિ કરી છે. જે પ્રસંશાને પાત્ર છે !! અભિનંદનને પાત્ર છે !!!

—શામજીભાઈ કે. પટેલ
બાળ શિક્ષણ શિબિર આયોજન સમિતિ,
પ્રેરણાપીઠ પીરાણા, તા. દસક્રોઈ, જી. અમદાવાદ–382425

ગુજરાત–વિભાગ બાળાઓ.

અનુ.	નામ	દિવાજોત	ધુપ ભોજન	સર્વે દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જપ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચંદ્ર દેવને	શાળ અભ્યાસ	ગુરુ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સંખ્યા
૧	મોહર કંપા	૨	૨	૧	૨	૨	૨	૨		૧	૧	૭		૪	૨	૩૦	૨
૨	બાબસર પંપા	૧	૧		૧	૧	૧									૧૪	૧
૩	લહેરી પુરા	૨	૨		૧	૨	૨							૧	૧	૧૦	૨
૪	જસવંત પુરા	૨	૨		૨	૨	૨			૧		૪	૨	૧	૨	૫	૨
૫	તખત ગઢ	૧	૧		૧	૧	૧									૧૦	૧
૬	માઢવા કંપા	૨	૨			૧	૨						૪			૩	૨
૭	મોડાસા	૨	૨	૧	૨	૨	૨	૨	૧	૨		૧૧	૪	૨	૨	૭૬	૨
૮	ગાજણ કંપા	૧	૧	૧	૧	૧	૧	૧		૧		૧૧	૪			૧૫	૧
૯	ખીલોડા કંપા	૧			૧	૧								૧	૧	૬	૧

realpatidar.com

realpatidar.com

અનુ.	નામ	દિવાબત્તી	ધૂપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચંદ્ર દેવને	થાળ [illegible]	ગુરૂ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સંખ્યા
૧૦	મોહનપુર	૨	૨	૨	૨	૨	૨	૨		૨		૧૧	૬	૨	૨	૨૮	૨
૧૧	મહાપુરકંપા	૨	૨	૧	૨	૨	૨	૧	૧	૧			૮	૨	૧	૨૫	૨
૧૨	લાલપુર કંપા	૫	૫	૩	૫	૫	૫	૩	૧	૧		૨૨	૮	૨	૧	૬૫	૫
૧૩	રામપુર કંપા (મોડાસા)	૩	૩		૧	૨	૩					૪				૨૨	૩
૧૪	દુધેલી	૨	૨		૨	૧	૨									૧૦	૨
૧૫	દુધાથલ	૩	૨			૨	૨									૧૧	૩
૧૬	ગત્રાડ	૨			૨	૧	૨								૧		૨
૧૭	ચાંપલપુર ફાર્મ	૧	૧		૧	૧	૧	૧	૧	૧				૧	૧	૨૦	૧
૧૮	નુતન ફાર્મ	૩	૩	૨	૩	૩	૩	૧	૧	૨		૩૩		૩	૩	૨૦	૩
૧૯	નવજીવન ફાર્મ	૩	૧		૧	૨	૩									૫	૩
૨૦	સલાલ (હીંમતનગર)	૫	૩	૧	૫	૪	૭	૨					૨	૫	૨	૧૧૧	૭
૨૧	ધનાલ કંપા	૪	૪	૩	૨	૨	૩			૧			૧	૨	૩	૮	૪
૨૨	અલવા કંપા	૩	૩	૧	૩	૩	૩	૧								૩૦૦	૩
૨૩	દીધીયા કંપા	૩	૩		૧	૩	૨	૧						૧			૩
૨૪	ખેરગઢ કંપા	૧															૧
૨૫	શીલવાડ કંપા	૧	૧	૧	૧	૧	૧	૧		૧	૧	૧૧		૨	૧	૧૦૦	૧
૨૬	મેત્રાલ કંપા	૨	૧		૧	૧	૨	૧		૧			૪	૧	૧	૧૫	૨
૨૭	સીંગલ કંપા	૪	૪	૨	૪	૪	૪	૩	૨	૪	૧	૨૨	૮	૮	૪	૨૧૫	૪
૨૮	ફેક્ટરી કંપા	૩	૩	૨	૩	૩	૩	૨	૨	૩		૮	૧૧	૩	૨	૬૦	૩
૨૯	કૃષ્ણપુર કંપા (સીણાવાડ)	૩	૩	૧	૧	૩	૩			૧				૨	૧	૧૭	૩
૩૦	ખેડાસણ કંપા	૮	૯	૩	૫	૬	૫	૧		૩			૬	૩	૩		૯

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n22/mode/1up

અનુ.	નામ	દિવાજ્યોત	ધૂપ લોબાન	સર્વે દેવોને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચંદ્ર દેવને	થાળ અક્ષરપાત	ગુરુ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સ.સંખ્યા
૩૧	ઈશ્વરપુર કંપા	૩				૨	૩										૪
૩૨	પંચવટી (ઇડર)	૩	૩	૨	૨	૨	૨	૨		૧		૨		૩		૧૦૨	૩
૩૩	પ્રતાપગઢ	૨૫	૨૪	૧૪	૨૦	૨૧	૨૫	૧૧	૨	૬		૯	૧૭	૧૧		૧૮૪	૨૬
૩૪	ડૉકટર કંપા	૪	૪	૨	૩	૩	૩	૧		૨		૧૧		૬	૩	૮૭	૬
૩૫	નહેરૂ કંપા	૧૬	૧૭	૭	૧૨	૧૭	૧૭	૨		૫		૩૭	૧૨	૧૧	૫	૧૦૩	૧૯
૩૬	વાવ કંપા	૧૬	૧૬	૪	૧૪	૧૫	૧૫	૨					૮	૮	૬	૧૩	૧૬
૩૭	નાણાં ફાર્મ (રાજસ્થાન)	૯	૯	૫	૯	૯	૯	૬	૧	૪			૩	૬	૧	૧૦૦	૯
૩૮	લીંબોઈ કંપા	૫	૫		૧	૪	૫			૧		૨	૨	૧	૧		૫
૩૯	હીરાપુર કંપા	૩	૩		૧	૨	૨										૩
૪૦	અમરાપુર કંપા	૫	૪	૨	૨	૩	૫										૫
૪૧	માળ કંપા	૧૪	૧૪	૮	૧૨	૧૩	૧૪	૭		૫		૧૧	૧૧	૧૧	૯	૮૩	૧૪
૪૨	જોગીવંટા કંપા	૨	૩			૧	૨			૧						૧૦૦	૪
૪૩	તાંદલીયા	૧૬	૧૬	૫॥	૧૫	૧૩	૧૫	૯	૧	૧૧		૧૯	૨૬	૧૭	૧૧	૧૭૬	૧૬
૪૪	જુનામેઘ કંપા	૪	૪	૧	૨	૨	૨	૧		૧			૮	૪	૧	૧૪	૪
૪૫	રવીપુરા (વડાલી)	૨૭	૨૭	૧૫	૨૨	૨૧	૨૪	૧૧	૪	૫	૧	૪૯	૩૯	૨૬	૨૧	૨૬૫	૨૮
૪૬	દામાવાસ કંપા	૨૯	૨૫	૧૧	૨૩	૨૩	૨૯	૧૪	૨	૧૧		૬	૩૭	૧૮	૧૭	૧૦૨	૩૨
૪૭	ધોળી વાવ	૯	૯	૫	૭	૮	૯	૫	૨	૫		૧૪	૧૧	૭	૩	૫૬	૯
૪૮	ગાડુ કંપા	૬	૬	૩	૬	૬	૬	૧		૧			૨	૧	૧		૬
૪૯	એડબ્રહ્મા માતાજી કંપા	૧૪	૧૪	૫	૯	૯	૧૧	૩	૧	૩			૪	૯	૭	૨૩૪	૧૪
૫૦	વાસણા કંપા	૧૯	૧૭	૮	૧૨	૧૩	૧૭	૩	૧	૩	૧	૧૮	૧૨	૩	૧૧	૧૬૫	૨૧
૫૧	દેલવાડા કંપા	૭	૬		૨	૪	૬	૧				૨	૧	૩	૩	૫	૮

realpatidar.com

અનુ.	નામ	દિવાજ્યોત	ધુપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સુર્ય નારાયણ	ચંદ્ર દેવને	થાળ અક્ષયપાત્ર	ગુરૂ વંદના	સંતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સંખ્યા
૫૨	જગમેર કંપા	૧૬	૧૫	૪	૧૪	૧૫	૧૫	૮	૫	૫		૧૭	૧૧	૧૨	૯	૫૫	૧૬
૫૩	આરસોલ કંપા	૩	૩	૧	૧	૪	૩									૧૫	૪
૫૪	દેસાઇપુરા કંપા (ડેમાઈ)	૫	૫	૪	૫	૫	૫	૫	૩	૧		૧૧	૮	૯	૨	૧૩૫	૫
૫૫	માધવ કંપા	૧૩	૧૨	૩	૧૨	૧૨	૧૨	૬		૨		૧૧		૧૨	૫	૨૬૦	૧૩
૫૬	બીબીપુરા રંપા	૩	૩	૧	૧	૩	૧						૪			૧૦૦	૩
૫૭	ધનસુરા=શીકા કંપા	૧૬	૧૬	૨	૧૪	૧૫	૧૨	૩		૯		૧૧	૧૬	૨૨	૯	૨૮૯	૧૬
૫૮	વજેપુરા કંપા	૧૦	૯	૯	૯	૧૧	૧૦	૮	૯	૮	૧	૨૨	૩૨	૭	૭	૧૧૮	૧૧
૫૯	ધરમેડા કંપા	૧૨	૧૦	૪	૧૧	૧૦	૧૨	૭	૨	૬	૧	૧૧	૧૯	૬	૫	૧૬૫	૧૨
૬૦	લાલુ કંપા	૧૨	૧૧	૬	૧૧	૧૦	૯	૫		૭		૧૧	૧૮	૧૮	૯	૨૭૧	૧૨
૬૧	ગઢ કંપા	૫	૫	૨	૩	૫	૫	૨		૩		૧૪	૮	૮	૩	૪૧	૫
૬૨	હરીપુરા કંપા	૧૧	૧૧	૬	૧૦	૧૧	૧૦	૬	૩	૯		૭૪	૧૩	૧૬	૮	૩૩૮	૧૧
૬૩	વેદ કંપા	૧૧	૧૧	૭	૧૧	૧૧	૧૧	૯	૫	૧૦	૧	૧૯	૧૩	૧૫	૬	૧૫૪	૧૧
૬૩	રામપુરા (હિમાઈ)	૨	૨		૧	૨	૨									૧૦૨	૩
૬૫	થરીલાટ (હિમાઈ)	૩	૩	૨	૩	૩	૩	૨	૧	૨		૨૨	૮	૪	૩	૬૫	૩
૬૬	હાથીપુરા કંપા	૭	૫	૨	૩	૭	૭	૧		૨				૪	૧	૨૦૨	૭
૬૭	કાપડી વાવ	૬	૬	૨	૫	૬	૫	૨	૧	૨		૨૧	૪	૬	૫	૬૫	૬
૬૮	રાજેન્દ્ર ફાર્મ	૫	૫	૩	૫	૫	૫	૫	૨	૪		૨૨	૧૨	૬	૪	૮૮	૫
૬૯	ત્રીવેણી ફાર્મ	૪	૪			૧	૩									૨૦	૪
૭૦	વડોદરા લાટ	૨	૨		૧	૧	૩	૧								૫	૩
૭૧	મણીનગર ફાર્મ	૩	૨	૧	૧	૨	૨	૧							૧	૧૦	૩
૭૨	નવસારી લાટ	૭	૭	૨	૭	૭	૭	૬				૧૧	૪	૭	૧	૬૫	૭

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n24/mode/1up

realpatidar.com

અનુ. નામ	દિવાજ્યોત	ધુપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચંદ્ર દેવને	થાળ અક્ષયપાત્ર	ગુરૂ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સંખ્યા
૭૩ પોકાર ફાર્મ	૧	૧			૧	૧							૧		૧૦	૧
૭૪ હેમપુરી લાટ	૩	૪	૧	૨	૪	૩	૧		૧			૫	૩	૨	૧૬	૪
૭૫ પાલડી લાટ	૭	૭	૨	૭	૭	૭	૫	૧	૫		૨૨	૪	૮	૬	૮૬	૭
૭૬ શીવપુરા લાટ	૩	૩	૧	૩	૩	૩	૨						૧		૨૫	૩
૭૭ ઉમીયા ફાર્મ	૫	૫	૧	૫	૫	૫	૨		૨		૧૧	૮	૫	૧	૧૧૦	૫
૭૮ ખાત્રેજ ચોકડી	૩	૩	૧	૩	૩	૩	૨		૧			૮			૩૦	૩
૭૯ કનીજ લાટ	૫	૪	૧	૩	૩	૪	૧	૧	૧			૪		૪	૪૫	૬
૮૦ અમીનપુરા	૬	૬	૩	૩	૩	૬			૧		૨૨		૬	૪	૨૦	૬
૮૧ ભવાનીપુરા	૧૭	૧૭	૧૪	૧૭	૧૬	૧૭	૧૬	૧૦	૧૦		૬૫	૩૯	૧૮	૧૦	૨૯૯	૧૭
૮૨ મહાદેવપુરા	૫	૫	૪	૫	૫	૫	૩	૨	૪	૨		૮	૬	૪	૧૬૫	૫
૮૩ નાહીસણુ કંપા	૫	૫	૨	૪	૪	૫	૩		૨		૧૧	૬	૫	૧	૫૫	૫
૮૪ આનંદપુરા કંપા	૧૨	૧૩		૧૦	૧૧	૧૨	૩		૪		૨૪	૬	૮	૯	૬૫	૧૪
૮૫ લવાડ ફાર્મ	૫	૫		૨	૩	૨	૧		૨	૧		૪	૪	૪	૪૦	૫
૮૬ કરસનપુરા કંપા	૫	૫	૫	૪	૪	૫	૧		૨		૧૯	૩	૫	૪	૭૨	૫
૮૭ રવીપુરા (મોડાસા)	૧૦	૧૧	૩	૮	૧૦	૬			૧		૨	૨	૬	૯	૫૫	૧૧
૮૮ અમરગઢ	૬	૬	૨	૬	૬	૬	૧						૧	૩	૪૫	૬
૮૯ નવા નારણપુરા	૧૦	૧૦	૭	૯	૯	૧૦	૮	૪	૮		૫૨	૧૬	૧૫	૮	૫૪૬	૧૦
૯૦ વિલાસપુરા કંપા	૩	૩	૧	૩	૩	૨	૩	૧				૩	૩	૪	૧૮	૩
૯૧ વડાલી કંપા	૮	૮	૧	૭	૮	૮	૨		૪		૧૬	૧૧	૫	૫	૯૯	૮
૯૨ જેતપુર કંપા	૫	૪		૪	૪	૫			૧			૨	૧		૩૧	૫
૯૩ ઈડર	૩	૩	૨	૨	૩	૨	૧	૧	૨			૪	૧		૨૫	૪

realpatidar.com

અનુ.	નામ	દિવાજ્યોત	ધુપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચાંદ દેવને	યોગ અભ્યાસ	ગુરૂ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સં. બા.
૯૪	ખરેડીયા કંપા	૩	૩	૧	૨	૨	૩	૧	૧	૧		૬	૩	૧	૧	૧૦	૩
૯૫	કંજેલી કંપા	૭	૭	૧	૭	૭	૭	૪		૩		૭	૧	૭	૨	૯૦	૭
૯૬	ગોતા કંપા	૬	૬	૪	૬	૬	૬	૪	૩	૪	૨	૪૧	૧૪	૭	૫	૧૩૫	૭
૯૭	બડોલ કંપા	૭	૬	૩	૫	૫	૭	૪	૧	૧				૨	૩	૪૭	૭
૯૮	લક્ષ્મણપુરા કંપા	૧૧	૯	૬	૮	૫	૧૦	૫	૧	૨			૧૪	૧૧	૧	૨૧	૧૫
૯૯	નારણનગર	૭	૭	૫	૭	૭	૭	૭	૨	૪	૨	૨૫	૮	૭	૪	૪૭	૭
૧૦૦	નવા રામપુરા	૪	૪	–	૪	૪	૪	૧	–	૨	–	–	૯	૨	૨	૪૦	૪

કચ્છ વિભાગ : બાળાઓ

અનુ.	નામ	દિવાજ્યોત	ધુપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચાંદ દેવને	યોગ અભ્યાસ	ગુરૂ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સં. બા.
૧	સાયરા	૨	૨	૧॥	૨	૨	૨	૧	૦॥	૧		૨	૪	૨		૨૫	૨
૨	રવાપર-નવાવાસ	૨	૨			૨	૨									૬	૨
૩	ખોભડી	૮	૮	૩	૬	૭	૯	૩	૧	૨			૧૩	૭	૧	૭૯	૯
૪	જનકપુર	૧	૧	૧	૧	૧	૧	૧	૧			૬	૪	૨	૧	૫૫	૧
૫	રતનાપુર																

અનુ.	નામ	દિવાજ્યોત	ધુપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચંદ્ર દેવને	થાળ અક્ષયપાત્ર	ગુરુ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સંખ્યા
૬	પદમપુર	૨	૨	૨	૨	૨	૨			૧		૨	૫	૨	૨	૩૦	૨
૭	ભુજ	૧	૧			૧	૧										૧
૮	વીરાણી (ગઢ)	૧૩	૧૩	૧	૫॥	૧૨	૧૬	૨		૦॥		૬	૭	૩	૧	૧૧૬	૧૬
૯	કુરબઈ	૧૯	૧૯	૬	૯	૧૬	૨૦	૧૨॥		૬		૧૨	૧૯॥		૩॥	૧૨૬	૨૦
૧૦	રસલીયા	૨	૨	૧	૧	૧	૨							૨		૨	૨
૧૧	વીગોડી	૬	૬	૪	૫	૬	૬	૪	૪॥	૧		૧૦	૧૦	૭	૧	૧૫૦	૬
૧૨	ઘડાણી	૫	૪	૨	૨	૩	૪	૨				૨	૬	૨		૨૬	૫
૧૩	નાગવીરી	૭	૭	૪	૬	૫	૭	૧॥				૬	૧૨	૫	૧	૭૦	૮
૧૪	આણંદસર	૧૬	૧૮	૯॥	૧૩	૧૪	૨૨	૯	૨	૧૭		૧૦	૨૬	૨૩	૧૯	૨૮૭	૨૩
૧૫	દેશલપર	૨૨	૨૦	૯	૧૬	૨૧	૨૩	૯	૧	૧૮		૧૬	૩૭	૨૨	૧૫	૩૩૨	૨૩
૧૬	કોટડા જ.	૪	૪	૪	૪	૪	૪	૪	૪	૪		૪	૧૬	૫	૪	૨૧૦	૪
૧૭	લક્ષ્મીપુરા (નેત્રા)	૮	૮	૪	૫	૮	૧૦	૩	૫	૪		૬	૧૨	૭	૩	૨૮૩	૧૦
૧૮	ભારાપર	૫	૫	૩	૩	૩	૩	૩	૧	૨			૫	૪	૩	૩૦	૬
૧૯	વડવા	૮	૬	૩	૪	૫	૬॥	૪	૨	૧		૧૬	૬	૬		૬૦	૯
૨૦	ભેરૈયા	૮	૯		૩	૬	૯	૨	૧	૧				૬	૪	૯	૧૦
૨૧	આનંદપર	૯	૪	૧	૧	૪	૫										૯
૨૨	અમરગઢ	૬	૭		૨	૫	૭						૧૨	૩	૪	૨	૮
૨૩	પાંતીયા	૧૧	૧૨	૨	૯	૧૧	૧૧	૪	૩	૪			૫	૧૦	૬	૩૮૬	૧૨
૨૪	માધાપર	૧૬	૧૪	૫	૮	૧૨	૧૭	૩	૧	૩			૧૨	૬	૧		૧૭
૨૫	ખેડોઈ	૧૬	૧૬	૮	૧૫	૧૬	૧૬	૧૧	૫	૮		૨	૧૪	૧૬	૬	૨૬૬	૧૬
૨૬	જીયાપર	૧૫	૧૫	૭॥	૫	૧૩	૧૪॥	૩	૧	૭		૨૩	૧૧	૧૩॥	૬॥	૧૫૪	૧૭

realpatidar.com

અનુ.	નામ	દિવાજ્યોત	ધુપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચંદ્ર દેવને	થાળ અક્ષયપાત્ર	ગુરૂ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ બા. સં.
૨૭	કલ્યાણપર	૨૪	૨૬	૧૧	૧૭॥	૨૦	૨૫	૧૦॥	૫॥				૧૯	૧૩॥	૫	૧૮૬	૨૮
૨૮	માનકુવા	૪૨	૪૦	૧૯	૨૫	૨૮	૩૭	૧૭	૯	૧૭		૬	૪૬	૩૨	૧૪	૭૩૮	૪૫
૨૯	નાના અંગીયા	૪૩	૪૨	૨૨॥	૩૭	૪૧	૩૯	૨૩	૧૩	૩૨॥	૪	૮૨	૮૦	૩૦	૨૭	૧૨૯૫	૪૫
૩૦	દુર્ગા પર	૨૫	૨૩	૬॥	૧૫	૨૦	૨૩	૬	૨	૯		૩	૩૪	૧૫	૬	૧૯૭	૨૫
૩૧	રાયણ	૧૫	૧૫	૧૧॥	૧૨	૧૪	૧૫	૧૦	૩	૬॥	૧॥	૨૨	૧૯	૧૭	૫	૨૮૨	૧૫
૩૨	જબલપુર	૧૦	૧૧	૬	૯	૧૦	૧૦	૭	૫	૪॥		૯	૧૬	૬	૫	૨૫૯	૧૧
૩૩	નાની ખાખર	૧૨	૧૨	૧૦	૧૧	૧૨	૧૨	૧૦	૯	૯	૩	૨૧	૨૮	૧૫	૧૦	૩૪૬	૧૨
૩૪	કાઠીયા નાના મોટા	૧૦	૧૦	૩	૮	૧૦	૧૧	૧		૪			૧૨	૯	૩	૨૩૦	૧૧
૩૫	નખત્રાણા	૭	૮	૩	૬	૭	૯	૫	૧					૩॥	૧	૫૪	૯
૩૬	ધાવડા	૩	૩	૧	૨	૩	૩	૨		૧		૨	૪	૨	૨	૬૨	૩
૩૭	મેરાઉ	૧૯	૧૮	૭	૧૩	૧૭	૧૮	૬	૧	૩॥	૧	૬	૧૭	૧૨	૫	૩૫૨	૨૦
૩૮	મમાય મોરા	૧૨	૧૨	૨	૭	૮	૧૩	૧		૪			૫	૬	૨	૭૨	૧૪
૩૯	દરસડી	૫	૬		૨	૫	૫	૨		૩			૬	૩		૮૧	૬
		૧૧૩૪	૧૦૪૩	૪૩૮॥	૭૯૫	૯૨૭	૧૦૩૬	૪૪॥	૧૬૨॥	૪૦૪॥	૨૪॥	૧૧૯૧	૧૧૯૨	૮૧૯	૪૭૬	૧૪૫૮૮	

શિબિરાથી બાળાઓએ ઉપરોક્ત મંત્રો કંઠસ્થ કરેલ છે. તેનું જનરલ સરવૈયું નીચે પ્રમાણે છે.

	બાળાઓની સંખ્યા
દિવા જ્યોતનો મંત્ર	કુલ ૧૧૩૪ = ૧૧૫૯
ધુપ લોબાનનો મંત્ર	,, ૧૦૪૩ =
સર્વ દેવને નમસ્કારનો મંત્ર	,, ૪૩૮॥ =
પ્રસાદ જમવાનો મંત્ર	,, ૭૯૫ =
જમ્યા પછીનો મંત્ર	,, ૯૨૭ =
સૂર્ય નારાયણનો મંત્ર	,, ૧૦૩૬ =
ચંદ્રદેવને નમસ્કારનો મંત્ર	,, ૪૪॥ =
થાળ–અક્ષયપાત્રાનો મંત્ર	કુલ ૧૬૨॥ =
ગુરૂ વંદના	,, ૪૦૪॥ =
સતપંથ સ્વરૂપ	,, ૨૪॥ =
પશ્નો	,, ૧૧૯૧ =
સંસ્કૃત શ્લોક	,, ૧૧૯૨ =
આરતી	,, ૮૧૯ =
પ્રાર્થના	,, ૪૭૬ =
શિક્ષાપત્રી	,, ૧૪,૫૮૮=

realpatidar.com

ગુજરાત વિભાગ : બાળ મિત્રો

અનુ.	નામ	દિવાજ્યોત	ધુપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચંદ્ર દેવને	થાળ અક્ષયપાત્ર	ગુરુ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સંખ્યા
૧	મહોર કંપા	૫	૬		૩	૫	૩	૧			૧	૭		૪	૨	૩૦	૬
૨	આબસર કંપા	૪	૪	૨	૩	૪	૪	૨							૧	૨૫	૪
૩	નારણુ નગર	૫	૫	૩	૫	૫	૫	૪		૩		૩	૪	૩	૪	૧૯	૫
૪	કંજેલી કંપા	૮	૧૧	૫	૬	૮	૮	૫			૧	૧૬	૨	૬		૭૫	૧૧
૫	જેતપુર કંપા	૬	૪		૩	૪	૫	૧								૧૦	૬
૬	શીવપુરા	૬	૪	૪	૬	૫	૫	૩	૨							૨૭૫	૮
૭	વીલાસપુરા	૮	૬	૧	૭	૬	૪		૧			૧૦			૩	૯૫	૮
૮	હર્ડેરીપુરા	૩	૩		૧	૩	૨								૩	૯	૩
૯	જસવંતપુરા	૫	૫	૧	૧	૪	૫	૧					૩		૪	૨૨	૫
૧૦	તખત ગઢ	૩	૩	૧	૧	૨	૨	૧		૧						૫	૩
૧૧	માહવા કંપા	૩	૩			૨	૧			૩						૨	૪
૧૨	નવા નારણપુરા	૧૦	૮	૬	૧૦	૧૦	૮	૫	૨	૨	૧	૧૩	૪	૫	૫	૧૮૨	૧૦
૧૩	અમર ગઢ કંપા	૬	૪	૧	૨	૫	૪	૧								૫૫	૬
૧૪	રવીપુરા (મોડાસા)	૧૧	૧૦	૨	૯	૧૧	૧૦	૫	૨			૫	૧	૧	૧	૫૨	૧૧
૧૫	કરસનપુરા કંપા	૧૦	૧૦	૪	૯	૯	૯	૩	૧	૪		૧૩	૬	૩	૮	૬૦	૧૧
૧૬	આનંદપુરા કંપા	૧૦	૮	૩	૧૦	૯	૯	૪		૩		૧		૮	૮	૫૧	૧૧
૧૭	મોડાશા	૨	૨	૧	૨	૨	૧	૧		૧				૧		૧૦	૨
૧૮	નાદીસણ	૫	૬	૨	૫	૬	૬	૪					૪	૪		૨૮	૬
૧૯	મણીપુરા	૩	૩	૨	૩	૩	૩									૧૦	૩

realpatidar.com
realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n29/mode/1up

1995-08 -Satpanth Jyot (111)

realpatidar.com

અનુ.	નામ	દિવાજ્યોત	ધૂપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચંદ્ર દેવને	થાળ અક્ષયપાત્ર	ગુરુ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સંખ્યા
૨૦	ગાજણ કંપા	૮	૮	૨	૭	૭	૬	૩		૩		૨	૮	૫	૪	૩૦	૯
૨૧	ખીલોડા કંપા	૩	૨		૧	૨	૨						૧	૧		૨૦	૩
૨૨	મોહનપુરા	૮	૭	૩	૭	૭	૮	૩		૪		૧૯	૬	૫	૧	૫૧	૮
૨૩	મહાપુરા	૪	૪	૧	૪	૪	૪	૩		૨			૬	૪		૧૪	૪
૨૪	મહાદેવપુરા	૧૨	૧૦	૩	૬	૧૦	૮	૪	૧	૩		૧૩	૬	૩	૫	૪૦	૧૩
૨૫	ભવાનીપુરા	૧૪	૧૪	૮	૧૩	૧૩	૧૩	૧૦	૪	૬		૫૫	૧૬	૩	૯	૪૯૯	૧૫
૨૬	લાલપુરા	૧	૧		૧	૧	૧	૧									૧
૨૭	સબલપુર	૬	૫	૧	૩	૫	૩	૧						૧	૧	૧૦	૬
૨૮	રામપુરા (મોડાસા)	૨	૨	૧	૨	૨	૨	૧								૧૦	૨
૨૯	દુધેલી	૨	૨	૧	૨	૨	૨					૧૧	૪		૧		૨
૩૦	અમીનપુરા	૩	૩	૧	૧	૩	૨	૧	૧	૧	૧	૧૧	૪	૪	૨		૩
૩૧	કનીજ લાટ	૫	૩	૩	૫	૫	૫	૨	૨	૧	૧	૧૧	૪	૨	૧	૩૦	૫
૩૨	દુધાથળ	૧	૧		૧	૧	૧										૧
૩૩	ખાત્રેજ ચોકડી	૯	૧૦	૩	૬	૭	૮									૪૫	૧૦
૩૪	ગત્રાડ કંપા	૧	૧			૧											૩
૩૫	નવસારી લાટ	૩	૩	૨	૩	૩	૩	૨								૩૫	૫
૩૬	પાલડી લાટ	૬	૬	૨	૫	૬	૬	૩	૧					૫	૫	૧૩૫	૮
૩૭	હેમપુરી લાટ	૪	૩		૧	૨	૨						૪	૩	૩		૬
૩૮	મણીનગર ફાર્મ	૫	૫	૨	૪	૫	૫	૩							૧	૧૫	૫
૩૯	ચાંપલપુર ફાર્મ	૫	૬		૪	૪	૩	૧		૧		૫		૧			૬
૪૦	વડોદરા લાટ	૪	૪		૨	૩	૧	૧									૪

realpatidar.com

અનુ.	નામ	દિવાજ્યોત	ધુપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચંદ્ર દેવને	ચાલ અસરપાત	ગુરુ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	ધર્મ.ના સૂત્રો
૪૧	જલારામ ફાર્મ	૪	૪	૩	૪	૪	૪	૧॥	૦॥							૩૦	૪
૪૨	નુતન ફાર્મ	૩	૩	૩	૩	૩	૩	૨		૧		૧૧		૨	૧	૪૦	૩
૪૩	નવજીવન ફાર્મ	૧	૧														૧
૪૪	ગુજરાત ફાર્મ	૩	૩	૧	૨	૨	૨	૧		૧			૪	૨		૧૫	૪
૪૫	ગોઠાજ લાટ	૭	૭	૩	૭	૭	૭	૧								૧૫	૭
૪૬	કાપડી વાવ	૫	૫	૩	૫	૫	૫	૩		૨				૨	૩	૨૦૨	૫
૪૭	મોતીપુરા કંપા	૭	૬	૪	૬	૬	૭	૨		૧				૬	૪	૧૪૭	૭
૪૮	હાથીપુરા કંપા	૯	૮	૫	૭	૮	૮	૩		૧			૪	૨		૩૪૫	૯
૪૯	રામપુરા કંપા (ડેમાઇ)	૬	૫	૧	૬	૫	૪	૩	૧					૮	૪	૧૨૦	૬
૫૦	સલાલ (હીંમતનગર)		૧		૧	૧	૧										૨
૫૧	હરીપુરા કંપા	૧૨	૧૦	૫	૭	૮	૯	૪		૯	૨	૨૨		૬	૮	૨૫૮	૧૨
૫૨	ગઢ કંપા	૬	૭	૨	૬	૬	૭	૪	૧	૧		૧૧		૪		૩૦૫	૭
૫૩	લાલું કંપા	૧૨	૧૨	૬	૧૨	૧૨	૯	૫		૫		૧૧	૫	૮	૮	૪૬	૧૨
૫૪	ધરમેડા	૧૩	૧૩	૭	૧૨	૧૨	૧૨	૬	૪	૫	૧	૧૧	૮	૧૫	૫	૫૫૩	૧૩
૫૫	વૈદ્દ કંપા (વડાગામ)	૭	૭	૬	૭	૭	૭	૬	૫	૫	૧	૩૩	૧૯	૧૦	૭	૨૮૮	૭
૫૬	ધનાલ કંપા	૩	૩	૩	૩	૩	૩	૩	૩	૨			૭	૪	૨	૨૧૧	૩
૫૭	વજેપુરા કંપા	૧૮	૧૪	૬	૧૯	૧૮	૧૭	૧૦	૬	૪		૨૨	૮	૬	૧૦	૧૪૫	૨૦
૫૮	ધનશુરા શીકા કંપા	૧૨	૧૧	૨	૮	૧૦	૯	૨		૩			૮	૮	૩	૨૧૨	૧૨
૫૯	અમરાપુરા કંપા	૩	૨		૨	૩	૨	૧		૧						૧૦૦	૩
૬૦	અલવા કંપા	૩	૨		૨	૪	૩									૩૦	૪
૬૧	માધવ કંપા	૨૦	૧૯	૧૦	૧૬	૨૦	૧૯	૧૧	૪	૬		૧૧	૮	૨૨	૧૧	૪૦૪	૨૦

અનુ.	નામ	દિવાજ્યોત	ધુપ લોબાન	સર્વ દેવોને નમસ્કાર	પ્રસાદ જમ્યાનો	જ્યોત પધિનો	સર્વૈ	નારાયણ	ચં. દ. દેવને થાળ	અક્ષરપાઠ	ગુરુ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સંખ્યા
૬૨	દેસાઈ પુરા	૧૭	૧૨	૭॥	૧૫	૧૬	૧૬		૫						૧		૨૭૦	૧૭
૬૩	દીધીયા કંપા	૪	૪	૧	૩	૪	૩		૩						૪	૪		૪
૬૪	ખેર ગઢ	૨	૨		૨	૨												૨
૬૫	બારસોલ	૩	૩	૧	૧	૨	૩										૧૫	૯
૬૬	જગમેર	૧૨	૧૨	૬	૧૨	૧૨	૧૧		૧૦	૧	૩		૧	૪	૧૩	૧૦	૧૦	૧૨
૬૭	શીલવાડ	૩	૩	૧	૩	૩	૩		૧				૧૧		૧		૧૧૫	૩
૬૮	વાસણા કંપા	૧૧	૧૧	૪	૮	૯	૮		૩		૧		૧	૩		૭	૪૫	૧૨
૬૯	ખેડબ્રહ્મા માતાજી કંપાં	૧૬	૧૫	૫	૧૫	૧૬	૧૩		૮	૩	૨		૧૧	૮	૬	૬	૨૨૩	૧૭
૭૦	દેલવાડા	૯	૯	૦॥	૩	૬	૪		૨	૧	૩		૮	૨	૪	૫	૯	૯
૭૧	મેત્રાલ કંપા	૬	૬	૨	૫	૬	૫		૩					૪	૧	૩	૧૦૦	૬
૭૨	ગાડું કંપા	૧૨	૧૨	૮	૧૧	૧૧	૧૧		૧૦	૩	૭		૧૧	૧૯	૬	૭	૩૮૮	૧૩
૭૩	સીંગલ કંપા	૧	૧		૧	૧	૧								૧	૧		૧
૭૪	ઘોળીવાવ	૩	૩		૧	૧	૩		૧									૪
૭૫	રવીપુરા	૧૯	૧૯	૬	૧૭॥	૨૦	૧૯		૭	૩			૨૯	૧૦	૧૪	૧૧	૨૧૪	૨૧
૭૬	તાંદલીલા	૨૧	૨૨	૧૦	૧૯	૨૧	૨૦		૧૪	૫	૫	૨	૬૮	૧૭	૧૨	૧૦	૬૫૨	૨૨
૭૭	દામાવાસ	૨૧	૧૮	૧૧	૧૫	૧૭	૧૮		૯	૨	૩		૨૧	૧૦	૨	૭	૧૩૧	૨૩
૭૮	ચાણોદ ફાર્મ (રાજસ્થાન)	૭	૭	૧	૨	૭	૬							૩	૪	૨	૫૦	૮
૭૯	વાવ કંપા	૬	૬	૪	૬	૬	૪		૩	૧				૩	૧	૩	૪૬	૬
૮૦	નાણાં (રાજસ્થાન)	૧૪	૧૪	૮	૧૧	૧૨	૧૩		૮	૪	૭		૧૦	૧૦	૯	૨	૨૯૦	૧૪
૮૧	ફેક્ટરી કંપા	૧	૧		૧	૧	૧				૧		૧૧		૧	૧		૧
૮૨	માળ કંપાં	૯	૧૦	૨	૮	૧૦	૧૦		૨				૫		૨	૩	૪૦	૧૦

https://archive.org/details/bk111-1/page/n32/mode/1up

realpatidar.com

અનુ.	નામ	દિવાજ્યોત	ધુપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચંદ્ર દેવને	ગાય અભયદાન	ગુરુ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સંખ્યા
૮૩	કૃષ્ણપુરા (શીણાવાડ)	૧	૧			૧	૧									૩	૧
૮૪	પંચવટી (ઈડર)	૩	૪		૩	૩	૩			૨			૬	૧			૪
૮૫	નહેરૂ કંપા	૧૪	૧૪	૩	૧૦	૧૨	૧૨	૬						૯	૩	૧૪૨	૧૬
૮૬	પ્રતાપગઢ	૧૮	૧૫	૧૦	૧૫	૧૮	૧૮	૧૦	૪	૬			૭			૯૮	૨૦
૮૭	ખેડાસણ	૧૦	૯	૫	૧૦	૧૦	૧૦	૧		૨			૪	૨	૨	૨૨	૧૦
૮૮	પોકાર ફાર્મ	૪	૪		૨	૩	૨								૧	૨૦	૪
૮૯	વડાલી કંપા	૩	૩	૩	૩	૩	૨		૧			૧૬	૩	૧	૨	૩૦	૩
૯૦	નવા રામપુરા	૬	૬	૨	૭	૬	૪	૪		૫			૧૪	૭	૫	૫૫	૭
૯૧	ગોતાં કંપા	૧૦	૧૦	૬	૧૦	૯	૯	૫	૪	૫			૧૮	૧	૮	૮૧	૧૦
૯૨	બડોલ કંપા	૧૪	૧૪	૩	૧૧	૧૧	૧૩	૫	૨	૨			૩	૨	૮	૨૯	૧૪
		૨૮૩	૨૭૧	૧૧૫	૨૩૦॥	૨૬૬	૨૫૧	૧૨૨	૩૬	૫૩	૨	૨૧૪	૧૪	૧૩૯	૧૦૯	૩૩૯૮	૩૦૬

કચ્છ વિભાગ : બાળ મિત્રો

અનુ.	નામ	દિવાજ્યોત	ધુપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચંદ્ર દેવને	ગાય અભયદાન	ગુરુ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સંખ્યા
૧	સાયરા	૫	૫	૦॥	૨	૪	૪					૨	૧	૩		૧	૬
૨	હરસડી	૧૩	૧૩	૩	૮	૧૧	૧૩	૨	૨			૨	૨			૨	૧૩
૩	મમાયમોરા	૨૧	૧૯॥	૧॥	૭	૧૫	૧૫॥	૨		૩				૨	૧	૬	૨૫
૪	મેરાઉ	૩૩	૩૪	૧૦॥	૨૩॥	૨૮॥	૩૦	૧૬	૩	૭			૧૦	૨૦		૩૧૦	૩૬

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n33/mode/1up

realpatidar.com

અનુ.	નામ	દિવાજ્યોત	ધુપ લોબાન	સર્વ દેવને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીનો	સૂર્ય નારાયણ	ચ ૬ દેવને	થાળ અક્ષયપાત્ર	ગુરુ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	શિક્ષાપત્રી	કુલ સંખ્યા
૫	નખત્રાણા	૨	૨		૧	૨	૨	૧								૧૦૦	૨
૬	કાદીયા નાના મોટા	૬	૭		૧	૩	૬	૧									૮
૭	નાની ખાખર	૬	૭	૫	૫	૬	૮	૪	૨	૧॥		૮	૭	૧	૩	૪૬	૮
૮	જબલપુર	૭	૮	૩	૮	૮	૮	૨	૨				૧૩	૧		૧૫	૮
૯	રાયણ-માડવી	૨૧	૨૨	૮॥	૧૯	૨૧	૨૨	૯	૨	૬॥	૧	૫	૧૨	૮	૧	૧૨૮	૨૩
૧૦	રામપર નેત્રા	૪	૫		૧	૪	૫			૨							૭
૧૧	દુર્ગાપુર	૨૬॥	૨૯	૧૨	૨૨	૨૩	૨૫	૧૨	૫	૬			૧૦	૮॥	૩	૨૬૬	૩૧
૧૨	માનકુવા	૨૭	૩૧	૧૫	૧૬	૨૧	૨૪	૪	૧	૫			૪	૧૭	૬	૭૦	૩૯
૧૩	નાના અંગીયા	૩૪	૩૪	૧૩॥	૨૩	૩૨	૨૨	૨૨	૬॥	૧૮		૫૬	૫૭	૨૨॥	૧૯॥	૮૭૧	૩૬
૧૪	આણંદસર	૧૪	૧૪	૪॥	૯	૧૧॥	૧૨	૪	૨	૯		૫	૧૨	૧૦	૭	૧૧૫	૧૭
૧૫	કલ્યાણ પર	૨૬	૨૮	૧	૧૩	૨૪	૨૩	૧૦				૨		૧॥	૨		૨૮
૧૬	જીયાપુર	૨૨	૨૪	૬॥	૫	૧૪	૨૦	૪		૩॥				૭॥	૧॥	૪૪	૨૬
૧૭	દેવપર	૨૨	૨૨	૧૮॥	૧૯	૨૦	૨૨	૧૩	૫	૩॥			૯	૯	૩	૩૦૭	૨૨
૧૮	રવાપર-નવાવાસ	૨	૨	૦॥	૧	૨	૧										૨
૧૯	ખોભડી																૨
૨૦	લક્ષ્મીપર -નેત્રા	૮	૧૧	૩	૪	૬	૭	૩	૩	૨		૧	૪	૪	૧	૧૦૪	૧૨
૨૧	કોટડા-જ.	૫	૭	૧	૫	૫	૬	૨		૨			૮	૨		૬૦	૭
૨૨	વીઘોડી	૬	૬	૨॥	૫	૬	૫	૨	૩	૦॥		૮	૨	૨		૬	૬
૨૩	ઘડાણી	૩	૪	૧	૧	૧	૩		૧			૧	૨	૧		૮	૪
૨૪	દેશલપર	૨૦	૨૨	૭	૧૩	૧૯	૨૧	૧૦	૧	૧૪		૧૬	૨૬	૧૬	૩	૬૭	૨૨
૨૫	નાગવીરી	૬	૭		૧	૨	૬							૫		૫૦	૧૦

realpatidar.com

realpatidar.com

અનુ.	નામ	દિવાજ્યોત	ધૂપ લોબાન	સર્વ દેવોને નમસ્કાર	પ્રસાદ જમવાનો	જમ્યા પછીતો	સૂર્ય નારાયણ	ચંદ્ર દેવને	ધ્યાન અક્ષયપાત્ર	ગુરૂ વંદના	સતપંથ સ્વરૂપ	પ્રશ્નો	સંસ્કૃત શ્લોક	આરતી	પ્રાર્થના	ઉત્તરપત્રી	કુલ સંખ્યા
૨૬	આનંદપર-જખ	૧૧	૧૪		૩	૫	૧૦			૦॥				૧		૫	૧૪
૨૭	રસલીયા	૭	૭	૧	૬	૭	૭	૧				૧	૭	૪	૧		૭
૨૮	કુરબઈ	૧૧	૧૨	૩॥	૪॥	૧૦	૧૧	૩		૩		૫	૨	૨		૩	૧૪
૨૯	વડવા કાંયા	૮	૧૩	૧	૮	૭	૯	૨॥	૧	૧			૫	૪॥		૪૧	૧૫
૩૦	જનકપુર	૫	૫	૩	૩	૪	૪	૩		૩		૫	૯	૬	૪	૩૦	૫
૩૧	વીરાણી	૨૦	૧૯	૧॥	૧૧	૧૫	૨૦	૫	૧	૨		૩	૭	૨	૧	૪૭	૨૩
૩૨	ભારાપર	૮	૮	૦॥	૬	૭	૬॥	૪		૪			૪	૬	૫	૨૫	૮
૩૩	ભેરૈયાં	૬	૭	૦॥	૪	૪	૮			૦॥				૧॥		૧૫	/
૩૪	ખેડોઇ	૯	૮	૨	૪	૬	૮	૩		૧॥				૨	૧	૫૫	૯
૩૫	પાંતીઆ	૩	૩		૧	૩	૩							૨			૩
૩૬	માધાપર-(નખત્રાણા)	૧૪	૧૪		૪	૧૨	૧૨	૧									૧૫
૩૭	રતનાપર	૨	૨			૧	૨										૩
૩૮	અમર ગઢ	૧૦	૧૩॥		૧	૪॥	૯	૨						૧		૧૦૦	૧૩
૩૯	કુકમા	૩	૩		૧	૨	૨										૩
૪૦	કનકપુર	૩	૩			૩								૧		૧૦	૩
૪૧	પદમપુર	૧	૧			૧											૧
૪૨	ભુજ	૨	૨			૨											૨×
		૧૧૧૬	૧૧૦૯	૩૮૨	૭૯૮	૬૭૮	૧૦૦૧	૪૧૫॥	૧૧૬	૨૩૭॥	૧૨	૬૫૦	૫૧૫	૫૦૬॥	૩૧૨	૧૧૨૪૦	×૧૨૫૨

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n35/mode/1up

realpatidar.com

શિબિરાર્થી બાળમિત્રોએ ઉપરોક્ત મંત્ર કંઠસ્થ કરેલ છે તેનું જનરલ સરવૈયું નીચે પ્રમાણે છે.

દિવા જ્યોતનો મંત્ર	૧૧૧૬	બાળ મિત્રોની સંખ્યા ૧૨૫૨	
ધૂપ લોબાનનો મંત્ર	૧૧૦૯	ગુરૂ વંદના	૨૩૭ાા
સર્વે દેવને નમસ્કારનો મંત્ર	૩૮૨	સતપંથ સ્વરૂપ	૧૨
પ્રસાદ જમવાના મંત્ર	૭૯૮	પ્રશ્નો	૬૫૦
જમ્યા પછીનો મંત્ર	૯૭૮	સંસ્કૃત શ્લોક	૫૧૫
સુર્યનારાયણ ને નમસ્કારનો મંત્ર	૧૦૦૧	આરતી	૫૦૬ાા
ચંદ્ર દેવને નમસ્કારનો મંત્ર	૪૧૫ાા	પ્રાર્થના	૩૧૨
થાળ અક્ષય પાત્રનો મંત્ર	૧૧૬	શિક્ષાપત્રી	૧૧૨૪૦

❋ ભજન ❋

લક્ષ્મીકાન્ત આઈ. પટેલ (લક્ષ્મણપુરા–ઈડર)

હે નિષ્કલંકી નારાયણ હું તારે દ્વારે આવ્યો છું

હે નિષ્કલંકી નારાયણ હું તારે દ્વારે આવ્યો છું,
સંકટોની નદી, દુઃખના ડુંગરો પાર કરતો આવ્યો છું;
ડૂબતો તરતો આવ્યો છું, હું પડતો ઉઠતો આવ્યો છું.
હે નિષ્કલંકી નારાયણ....

ફરિયાદ નથી તુજથી કોઈ, નથી અસંતોષ દુનિયાથી,
આ માનવ દેહ મળ્યો છે તો, ભોગતો ભોગતો આવ્યો છું;
હે નિષ્કલંકી નારાયણ...

નથી માંગતો સોના–ચાંદી, નથી માગતો હીરા–મોતી,
મળ્યો છે ખજાનો પ્રેમ તણો, હું લૂંટતો લૂંટતો આવ્યો છું;
હે નિષ્કલંકી નારાયણ....

જાણે અજાણે કર્યા ગુન્હાઓ, બન્યો છું તારો ગુન્હેગાર,
દિલમાં ભરી પસ્તાવાઓ, હું માફી માંગતો આવ્યો છું;
હે નિષ્કલંકી નારાયણ....

આ દુનિયાદારી જંજીર છે, તારૂં ધામ જ આખરી મંજિલ છે,
તારે દ્વારે આવી ઉભો છું, તને ભજતો ભજતો આવ્યો છું;
હે નિષ્કલંકી નારાયણ....

કરવી હોય તો કર તું કસોટી, એ તો છે તારી રીત પુરાણી,
ધ્રુવ–પ્રલ્લાદની અટલ શ્રદ્ધા, દિલમાં લેતો આવ્યો છું;
હે નિષ્કલંકી નારાયણ....

ન કરતો આજ નિરાશ મને તું, હું આશા લઈને આવ્યો છું,
રડતાં રડતાં જન્મ્યો હતો, હું હસતો હસતો આવ્યો છું;
હે નિષ્કલંકી નારાયણ...

હે નિષ્કલંકી નારાયણ હું તારે દ્વાર આવ્યો છું.

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n36/mode/1up

realpatidar.com

રામની સેના જેવી મૂકસેવકોની સભા

ધર્મગ્રંથ રામાયણમાં સીતાજીનું હરણ કર્યુ હતું. તેનો ઉલ્લેખ ઘણો જ સુંદર રીતે કરવામાં આવેલ છે. લંકાપતિ રાવણે સીતાનું હરણ કર્યું. શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો. સવાલ પેદા થયો લશ્કરનો રામ જો ધારત તો તે અયોધ્યામાં જઈ અગર સમાચાર મોકલાવી મોટું લશ્કર મંગાવી શકત પરંતુ રામે ફક્ત વાનરાઓની સેના જ બનાવવાનું નક્કી કર્યું. રામે વિચાર્યું કે જો લશ્કર મંગાવો તો તેને માટે જંગલમાં મોટું રહેઠાણ, ભોજન, અને ઇતર સામગ્રીઓનું આયોજન કરવું પડે ને? રામે ફક્ત વાનરસેના જ રાવણ સાથે યુદ્ધ કરવા બનાવી કે જેમાં રહેઠાણ, ભોજન, કે ઇતિર વસ્તુની જરૂર જ ન પડે. રાવણ સાથેની રામ અને વાનરસેનાની લડાઇ રામનો વિજય થયો. રાવણ મરાયો સીતાજીને પાછા લાવ્યા.

ગાંધીજીના સિદ્ધાંતો જેવા કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઇતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઇ થકી ના અભડાવું, અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગને સર્વધર્મ સરખા ગણવાં, આ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવા, માટે ગામડે પૂ. સ્વ. રવિશંકર મહારાજ, કાકાસાહેબ કાલેલકર, જુગતરામ દવે, દિલખુશ દિવાનજી, બબલભાઈ મહેતા જેવા હજારો કે લાખો મૂકસેવકો ફરતા હતા. તેઓ દરેક ગામડે ગામડે સભા ભરીને ઉપદેશ આપતા જેમાં સાદાઇથી ગામડામાં રહેવું. ગ્રામોદ્યોગ કે ગૃહઉદ્યોગ કે ખેતીવાડી, પશુપાલન કરવું વિ. વિ. સભાના આયોજનમાં ન મળે મંડપ કે ન મળે લાઉડ સ્પીકર કે શણગાર.

ગ્રામ્યજનો હાથઘંટીનો લોટ, હાથ છડચોખા, ઘાણીનું તેલ, દુધ દહિ જેવી વસ્તુ ખાતા જેથી અને પગપાળા પ્રવાસથી લાંબુ જીવન જીવી જાતા હતા. હજુ પણ ગાંધીજીના સિદ્ધાંત અનુસાર ચાલનારા વૃદ્ધો છે જેમાં જુવાનીનું જોર અને ખમીર મોજૂદ છે. રામાયણ મહાભારત, સારી નોવેલ કે સામાજિક કથાઓનું વાંચન રાખી આચાર વિચારો શુદ્ધ રાખતા. ન મળે પતિપત્ની ઝઘડા, ન મળે મારામારી, ન મળે ચોરી ફક્ત બધી જગાઓનું વાતાવરણ શાંતિપ્રિય, ઉમંગ કે ઉલ્લાસી હતું.

પહેલાં ફક્ત બગાડો, ઝઘડો શહેરમાં જ હતો જેથી ગામડાંની પ્રજા શહેરમાં જવા ઇચ્છતી ન હતી. આજે તો શહેર કરતાં ગામો દિનપ્રતિદિન બગડી રહ્યા છે. વિવિધ પ્રકારના ભોજન, બિભત્સ વાંચન આખી રાત દૂરદર્શનમાં બતાવાતા ચિત્રો કે વીડીયોમાં ધ્યાન કેન્દ્રીત થઈ રહ્યું છે. ગામડાંના લોકો આજના અભ્યાસ અને અનુભવ મુજબ લગભગ ૪૦ થી ૫૦ વર્ષમાં જ વૃદ્ધ થવા માંડયા છે. અગર મટી રહ્યાં છે એનું કારણ શું છે?

હાલમાં શહેરો કે ગામમાં પૈસા વધુ છે પરંતુ તે લક્ષ્મી નથી ફક્ત કાગળો ઉપર સરકારે મારેલી મ્હોરજ છે. આજના મહોલમાં માણુસ પૈસાને ખાઈ શકવાનો નથી જ પરંતુ પૈસા જ માણસને ખાઇ જશે અને જીવન બરબાદ કરશે જ એમાં શંકા નથી જ હાલમાં ગામડાં કે શહેરો આગળ વધી રહ્યા છે પરંતુ સુખ, શાંતિ સંતોષ કે ધીરજ ગુમાવી રહ્યાં છે. આગળ વધેલા આપણને પાછળ જ જવું પડશે જ. મતલબ ભારતીય સંસ્કૃતિ, પ્રણાલિકા કે સિદ્ધાંતને પુન જીવન આપવું પડશે. તોજ આપણું આયુષ્ય વધશે. સુખ શાંતિ સંતોષ કે ધીરજ આવશે જ.

સુખલાલભાઈ ગોપાલ પટેલ
ભીમપોર–સુરત.

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n37/mode/1up

realpatidar.com

સીતાજીના જન્મનું રહસ્ય ?

–મહેન્દ્ર એમ. પટેલ. વડાલી S.K.

દાનવરાજ રાવણનો અત્યાચાર દિવસે ને દિવસે વધતો જતો હતો. તે ભારત વર્ષમાંથી સુંદર સુંદર રાજકુમારીઓનું અપહરણ કરી લંકામાં લઈ જતો. ભારતમાં દરેક જગ્યાએ તેની આણ વર્તાતી હતી. ભારતના દરેક ઋષિ મુનિઓનો રાજા ધિરાજ અને ભગવાન જાણે રાવણ ન હોય તેમ તેણે કોઈ પણ વ્યક્તિને હોમ-હવન-ધૂપ કે દીપ તથા કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ કરવાની મનાઇ ફરમાવી હતી.

તમસા નદિના કિનારે એક ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના મુખ્ય અધિષ્ઠાતા ઋષિ વાલ્મિકીએ સમગ્ર ભારતભરના સાધુસંતોને તથા ઋષિમુનિઓ અને ભકતોને યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ રાવણના ડરથી કોઈપણ સાધુઓ યજ્ઞમાં આવ્યાં નહિ. જે અમુક માથાનાં હતાં તે આવ્યાં નિશ્ચિત દિવસે યજ્ઞ શરૂ થઈ ગયો. રાવણને તેના ગુપ્તચરોથી યજ્ઞ માહિતી મળી કે ભારતમાં ભવ્ય યજ્ઞ થઈ રહ્યો છે. તેણે તુરત જ પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે, “ સૈનિકો યજ્ઞમાં અશૂધિ નાખી યજ્ઞ બંધ કરાવો. યજ્ઞ કરતાં તમામ સાધુ બાવાને પકડીને અહીં લઈ આવો ”

દાનવરાજ રાવણની આજ્ઞા થતાં સર્વે અસૂરો હાથમાં ખડ્ગ લઈ તમસા કિનારે પહોંચી ગયા. યજ્ઞમાં વિઘ્ન નાખી યજ્ઞ કરતાં ઋષિઓ તથા તેમના મુખ્ય અધિષ્ઠાતા મહર્ષિ વાલ્મિકીને લોંખડની બેડીઓ પહેરાવી રાવણ સમક્ષ હાજર કર્યા. વાલ્મિકી અને સર્વે સાધુઓને જોતા જ રાવણ બરાડી ઉઠયો “ બાવાઓ ખબર નથી ? મારા રાજ્યમાં કોઈ એ યજ્ઞ નહિ કરવાનો ! મારા રાજ મહેલમાં પવન પાણી ભરે છે, નવ ગ્રહ દેવતાં બંદી છે. ત્રેત્રિસ કરોડ દેવો મારાથી ફફડે છે અને તું એવા દેવનો યજ્ઞ કરે છે ? જે હાથે તે યજ્ઞમાં આહુતિ આપી છે. તે હાથને તારા શરીરની અલગ કરી દેવામાં આવશે. હું કોણ ત્રિલોક સમ્રાટ રાવણ ?

આ અહંકાર ભર્યા વેણ સાંભળી વાલ્મિકીજી એ શિખામણના ઘણા શબ્દો કહ્યાં પરતું ‘પથ્થર ઉપર પાણી’ એ ઉક્તિ અનુસાર રાવણ પર કંઇ અસર થઈ નહીં. છેવટે બધા સાધુઓના કાંડા કાપી લેવામાં આવ્યાં. તેને એક મટકીમાં ભરી સમુદ્રમાં વહેવડાવવાના હતા ત્યાં તો વાલ્મિકિજીએ પોતાના તપો બળની શક્તિથી રાવણને શ્રાપ આપ્યો કે “ હે અભિમાની રાવણ ! સાંભળ કાન ખોલીને સાંભળ ! આ મટકીમાંથી જે નીકળશે તે તારા કુળના સંહાર માટે નિમિત બનશે !’ જો આ મટકી એક વર્ષ તારા રાજ્યમાં રહેશે તો તારા રાજ્યનો નાશ થશે અને તારા રાજ્યમાં દશ વર્ષ સુધી દુષ્કાળ પડશે !!!

રાવણે આ મટકીને મિથિલા રાજ્યની હદમાં દટાવી. મહિર્ષના શ્રાપના કારણે મિથિલામાં ઘણા દુષ્કાળ પડયા છેવટે જ્યારે પ્રજા પાલક કુશ ધ્વજ જનક રાજા તથા રાણી અને શૂન્યા જ્યારે ધૂસરી ગળા પર લઈ ખેતર ખેડે છે, ત્યારે એજ ખેતરમાંથી રાવણે પેલી મટકીના કાંઠલામાં હળની અણી ભરાઈ જાય છે. તથા મટકીમાંથી એક બાળકી બહાર આવે છે. જનક રાજા નિઃ સંતાન હતાં તેથી તે આ બાળકીનો ઉછેર કરે છે. આ પુત્રી એજ જગત માતા લક્ષ્મીજી જે બાળપણમાં શિવ ધનુષ્યથી રમતી હતી. જેને સ્વયંવરમાં પરમેશ્વર રામ સાથે વરી જીવન ધન્ય બનાવ્યું. જેનું પાત્ર ભારત ભરની નારીને આદર્શ નારીની શીખ આપે છે. સીતાના પાત્ર દ્વારા સુખ કે દુઃખમાં પણ પોતાના પતિનો સાથ-નિભાવવાની શિખામણ આપે છે. રાજાની રાણી પણ સામાન્ય નારીના જેમ જંગલમાં રહી શકે છે. નહિ કે છૂટા છેડા લઈને ? □

realpatidar.com

realpatidar.com

આપણું શિક્ષણ

–ભરત એ. પટેલ
વિઠ્ઠલપુરા (કપડવંજ)

આપણા દેશની આઝાદી પછી અને ખાસ કરીને દેશના આયોજન મુજબ અનાજ, પાણી, રહેઠાણ, પોષાક જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની જેમ બીજી પાયાની જરૂરિયાત શિક્ષણની છે. એકંદરે બીજી જરૂરિયાતો કરતાં પણ શિક્ષણ એ જીવન ધોરણ માટે મુખ્યત્વે અગ્રિમ છે. કારણ કે શિક્ષણના કારણે માણસના જીવનનો રસ્તો સરળ બને છે. અને સરળતાથી મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધે છે. જેથી શિક્ષણ એ જીવન જરૂરિયાત નો પાયો ગણીએ તો ખોટું પણ નથી. શિક્ષણ એટલે માર્ગદર્શન, જીવનમાં ઘડતર લાવવા માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણના કારણે ઇચ્છીત વ્યક્તિ પ્રયત્ન કરવાથી ઉન્નતિ મેળવી શકે છે. શિક્ષણ એટલે અનેક નિરાશાઓની એક આશા.

શિક્ષણથી અનેક નિરક્ષર માણસો અક્ષરસ : જ્ઞાન મેળવે છે. વહેમ, અંધશ્રદ્ધા, બેદરકારી, કુટેવો, અવૈજ્ઞનિક દૃષ્ટિ, ખોટા રીતરીવાજો વગેરેથી બચી શકે છે. અને શારીરિક માનસિક, સ્વાસ્થ પર ખરાબ અસરો પડતી નથી. શિક્ષણના કારણે સમતોલ અહાર, ખોરાકની સાચવણી સુયોગ્ય રસોઈ બનાવવી સ્વાસ્થયને કયો ખોરાક અનુકુળ રહે તેની જાણકારી રહે છે. ગંદકીથી દુરરહે વ્યસન મુક્ત રહે એકંદરે શિક્ષણ એટલે જીવન ધોરણ ઊંચું લાવવાની ચાવી છે. શિક્ષણ શાળામાં પ્રૌઢશિક્ષણ, ટ્યૂશન પદ્ધતિથી આપવામાં આવે છે. શાળામાં શિક્ષણ આપવાની પદ્ધતિ મહદ્ અંશે સફળ ગણી શકાય. આધુનિક શિક્ષણ વર્ગમાં આપવાનું એક બાજુ રહી જાય છે. ને સામાજિક વાતોમાં મિત્રમંડળ ને એકઠું કરી સમય વીતાવે છે. અભ્યાસક્રમ પૂરો કરવામાં આવતો નથી. ગરીબ કુટુંબના બાળકોને વર્ગમાં અપાતા શિક્ષણ સમયમાં જેટલું શિક્ષણ મળ્યું તે સાચું તે સિવાય જાતે વાંચન કરીને તૈયાર થવું પડે છે. શક્તિના હોય તેવા બાળકો છેવટે અભ્યાસ પડતો મૂકે છે. જ્યારે ધનીકોના બાળકો ખર્ચ કરીને ટ્યૂશનથી શિક્ષણ પ્રાપ્ત કરે છે. તેઓનાં બાળકો આગળ જાય છે. પૈસા માટે બુદ્ધિજીવીઓ પોતાની સ્કૂલો ઊભી કરી મનમાન્યા પૈસા એકઠા કરે છે. શિક્ષણ નો વેપાર કરી બેઠા હોય છે. વિદ્યાર્થીનું શું થશે તેની સહેજ પણ દરકાર રાખતા નથી આપણો ખેતી પ્રધાન દેશ વધારે ને વધારે ગરીબ બનતો જાય છે. અસમાનતા વધી છે.

પૌઢ શિક્ષણ કાર્યમાં વૃદ્ધો નિરક્ષર પ્રજા લખી–વાંચી શકે અને સમજી શકે. તે માટે રાત્રિ વર્ગો ચલાવવામાં આવે છે. આવા વર્ગોમાં ફક્ત હાજરી પૂરવામાં આવે છે. આયોજન મુજબનું કાર્ય થતું હોતું નથી. કેન્દ્ર સરકાર દ્વારા આપતી ગ્રાન્ટ મેળવી લેવાય છે. આપણા શિક્ષણમાં જુદા જુદા આંદોલનો, એલાનો તોફાનોની વિપરીત અસર થતી હોય છે. શિક્ષણ સંસ્થાઓ શિક્ષણ સ્થગિત થતાં શિક્ષણ કાર્ય પુરૂ થતું નથી. એ તે નુકશાન શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને સહન કરવું પડે છે. આવા પરિબળો માટે મુખ્યત્વે આપણા દેશનું રાજકારણ જવાબદાર ઠરે છે. આપણાં શિક્ષણમાં ફક્ત કાગળો ઉપર કામગીરી બોલે છે. શિક્ષણ પૂરતું પ્રાપ્ત થતું નથી. વસ્તી વધારાના કારણે શિક્ષિત બે રોજગારો દિન પ્રતિદિન વધી રહ્યા નજરે પડે છે. રોજગારીની તકો પૂરી પાડવામાં આવતી નથી. તેઓની શક્તિનો ઉપયોગ આજની સરકાર કરતી નથી. દરકાર પણ કરતી નથી શિક્ષણ પાછળનો ખર્ચ તદ્દન નકામો જાય છે. ટ્યુશન પ્રથા અને બીન જરૂરી પ્રૌઢશિક્ષણ બંધ કરી સારા વહીવટ નીચે નવું શિક્ષણ સાચી સચોટ પદ્ધતિથી મેળવી શકે તેવું આયોજન ઘડવું જોઇએ.

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n39/mode/1up

realpatidar.com

આમ આપણું હાલનું શિક્ષણ એ શિક્ષણ નથી. પરંતુ ખોટાં કૃત્યો કેવી રીતે થાય તેનું માર્ગદર્શન આપવામાં આવે છે. શિક્ષણએ દેશની જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા છે તેમ છતાં તેમાં ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. આવા ભ્રષ્ટાચાર શિક્ષણમાં જ્યાં જ્યાં જણાય ત્યાંથી દૂર કરવા જાગૃત રહેવું ઘટે.

"વિદ્યા પૈસો મેળવવા માટે ભણવાની નથી વિદ્યા તો જીવનનું દર્શન કરવા સુખ, શાંતિ અને સમાધાન મેળવવા તેમજ ઇસ તત્ત્વ પાસે પહોંચવા મેળવવાની છે."

અનમોલ વચન

संकलन : D. J. PATEL
VILLAGE PATEL FARM
Po. Chanoud (pali)
Raj : 306602.

1. इतने नरम मत बनो कि लोग तूम्हे खा जाए ।
2. इतने गरम मत बनो कि लोग तूम्हें छु भी न सके ।
3. इतने सरल मत बनो कि लोग तूम्हें मूर्ख बना दे ।
4. इतने जटिल भी मत बनो कि लोगो से तूम मिल न सको ।
5. इतने गंभीर भी मत बनो कि लोग तुमसे ऊब जाये ।
6. इतने छिछले मत बनो कि लोग तूम्हें माने ही नहीं ।
7. खूबसुरती हृदयसे होती है न कि शरीर से।
8. राम किसी को मारे नहीं न हत्यारा राम । अपने आप मर जासीं कर-कर खोटे राम ॥
9. विज्ञान निष्कर्ष तक पहुँचता है, धर्म निश्चय तक । विज्ञान सन्देह हल करके निष्कर्ष लेता है धर्म मुल होकर ॥
10. जिसके हृदयमें प्रेम न हो वह हृदय श्मशान घाट के समान हैं । —" कबीरदास "
11. O God thou art Omnipresent and Omnipotent.
12. Learn to obey if you wish to Command.
13. Misfortune is the touchstone of friendship.
14. fortune favours the brave.
15. He has no religion who has no hamanity.

" સતપંથ જ્યોત " ના ગ્રાહકોને વિનંતી

સતપંથ જ્યોત મંગાવતા તમામ ગ્રાહકોને જણાવવાનું કે તમામ ગ્રાહકોને અંક ચકાસણી કરી રવાના કરાય છે. તેમ છતાંય કોઈ ગાહકને અંક ન મળે તો ગ્રાહક નંબર સાથે કયો અંક નથી મળ્યો તે વિગતે નીચેના સરનામે લખવું જેથી તે અંગે ઘટતું કરી શકાય. !!!

—શામજીભાઈ કે. પટેલ
શ્રી સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ
જી. અમદાવાદ-382425

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n40/mode/1up

realpatidar.com

❋ માતૃદેવોભવ પિતૃદેવોભવ ❋

—પંકજ સી. પટેલ વડોદરા.

આપણી ધરતી પર માતૃદેવોભવ, પિતૃદેવોભવ, નો મહીમા ઋષીમુનીઓએ વર્ણવ્યો છે, ભારતીય સંસ્કૃતીનો અણમોલ વારસો છે. આપણા સંતોએ રાજામહારાજાઓ સૌએ માતા પિતાની સેવા પુરા ભકતી ભાવથી કરી તેમના હૃદયના આશીર્વાદ મેળવી જીવન ધન્ય બનાવ્યું છે. શ્રી રામે પિતાનું વચન પાળવા ૧૪ વર્ષનો વનવાસ વેઠયો હતો. ભક્ત પુંડલીકે ભગવાનની સેવાથી પણ માતાપિતાની સેવાને વધુ મહત્વ આપી પ્રભુને વશ કર્યા હતા. અને પ્રભુના પ્યારા બન્યા હતા.

એવી આ મહાન ભારત ભુમીમાં જન્મ્યા છીએતે આપણું અહોભાગ્ય છે આ અહોભાગ્યને જાળવી રાખવા આપણે પણ આપણાં માતા પિતાની સેવા કરીને એમના અંતરના રૂડા આશીર્વાદના અધિકારી બનવું જોઈએ. કારણ કે આપણને જન્મ આપી જતનથી ઉછેર્યા, આપણે માંદા હોઈએ ત્યારે રાત્રીના-ઉજાગરા વેઠી આપણી સારવાર કરી આપણા મળ, મુત્રની પરવા કરી નથી, અનેક મુશ્કેલીઓ વેઠીને આપણને ભણાવ્યા કેટલીક લાગ વગથી નોકરી કે ધંધા પર ચઢાવ્યા, જરૂર પડે તો દેવું કરીને પણ હર્ષ ભેર પરણાવ્યા આવાં મહા ઉપકારી મા બાપ ઘરડાં થઈ જાય એટલે તેને દુખી કરીએ. એમનું અપમાન કરી દુભવીએ. જે ઘર એમણે વસાવ્યું હતું. બનાવ્યું હતું. એ ઘરમાંથી એમને બહાર હડસેલી વૃદ્ધાશ્રમમાં ધકેલી દઈએ તે કેટલી બધી ક્રૂરતા કહેવાય. એવો, અત્યાચાર આપણે ન કરીએ. આપણાં બાળકોને પણ દાદા-દાદીનું વ્હાલ મળે. અને તેનાથી બાળક સંસ્કારી બને એવી કાળજી રાખીએ. અને સદા સુખમાં અને સંતોષમાં રહી આપણા ઉપર સદા આશીર્વાદ વરસાવ્યા કરે. એવું વર્તન કરીએ. કોઈ પણ માતા પિતા પોતાના સુખકે આનંદ માટે પુત્રને દેવું કરવા કે મિલ્કતનું લીલામ કરવાનું કહેતાં નથી. માતા પિતા તો પોતાના પુત્રના સુખ અને દુઃખમાં સહભાગી થઈ જીવન વિતાવે છે.

આપણે નાના હતા ત્યારે આપણી બધી હઠને પુરી કરીને આપણને રાજી કર્યા હવે તો પછી એમના કોઈક અપ્રહને આપણે શા માટે ન નભાવીએ ? આપણા બાળપણને એમણે એમણે જાળવ્યું. તો એમના ઘડપણને આપણે જરૂર જાળવીએ આ અગાઉ આપણે કદાચ ભુલ કરી બેઠા હોઈને આપણા વર્તનને લીધે. કદાચ મા બાપના હૃદયને ઠેસ પહોંચી હોય, તેમના અંતર દુભાયાં હોય. તો આપણી ભુલનું પાયશ્ચિત કરી આંખોમાં આંસુ સાથે માતા પિતાની માફી માગીએ અને "જાગ્યા ત્યાંથી સવાર" સમજીને તેમની ભકતી ભરી સેવા કરી આકરા અભિશાપથી બચીને અને અંતરના રૂડા આશીર્વાદ મેળવી જીવન ધન્ય બનાવીએ. કવીએ કહ્યું છે કે "ભુલો ભલે બીજું બધું મા બાપને ભુલશો નહીં'. અગણીત છે ઉપકાર એના એક-વિસરશો નહીં'." માતા પિતાએ શંકર-પાર્વતીનું સ્વરૂપ છે. અડસઠ તિર્થનું ફળ માતા પિતાની સેવાથી મળે છે. સંતોએ પણ "માતૃદેવોભવ પિતૃદેવોભવ" ને પોતાના જીવનમાં અને સત સંગમાં પ્રથમ સ્થાન આપ્યું છે.

realpatidar.com

https://archive.org/details/bk111-1/page/n41/mode/1up

realpatidar.com

Satpanth Jyot (MONTHLY) August-1995 Regd. No........

* ઈશ્વરની ઉપાસના *

કુ. નીતા એલ. ભીમાણી
મેરાઉ-કચ્છ

જે મનુષ્ય ઇશ્વરની ઉપાસના કરતો નથી તે કૃતઘ્ન અને મહામૂર્ખ છે. કારણ કે પરમાત્માએ સર્વ જીવોના સુખ માટે અનેક પદાર્થો બનાવ્યા છે. તેના એ ઉપકારને ભૂલી જવો અને ઇશ્વરને ન માનવો એ કૃતઘ્નતા અને મૂર્ખતા જ છે.

ઇશ્વરની ઉપાસના કરવાથી આત્માનું બળ એટલું બધું વધે છે કે પર્વત સમાન દુઃખ હોય તો પણ તે નીડરપણે સહન કરી શકાય છે. તો પછી નાના દુઃખોની તો વાત જ શી ?

મનુષ્ય જ્યારે ઉપાસના કરવા લાગે છે ત્યારે તેનો આત્મા પવિત્ર થાય છે. અંતઃકરણ નિર્મળ થઈ સત્યથી પરિપૂર્ણ થાય છે. દિન-પ્રતિદિન જ્ઞાન-વિજ્ઞાનને વધારીને મુક્તિ સુધી પહોંચી જાય છે. આઠ પ્રહરમાં એક ઘડી પણ જો મનુષ્ય ઇશ્વરનું ધ્યાન ધરે તો તે જરૂર ઉન્નતિ કરી શકે.

From :-
સતપંથ જ્યોત
C/o. સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ-382425.

To

Printed-Book

Book-Post

realpatidar.com